



સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4tahomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal4tahomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 08 JULY, 2022 Vol. 19, No. 27 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

બ્રિટનમાં 41 મંત્રીઓએ ધડાધડ રાજીનામાં આપી દેતાં બોરિસ જોન્સન ભીંસમાં આવ્યા બળવો થતાં બ્રિટન PM જોન્સનનું રાજીનામું

કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી જોન્સન પીએમ પદે યથાવત રહેશે, ઓક્ટોબરમાં ચૂંટણીની શક્યતા

લંડન

બ્રિટનમાં બોરિસ જોન્સન સામે અસંતોષ આખરે ભડકી ઊઠ્યો હતો. કેબિનેટમાંથી 40 જેટલા પ્રધાનોના રાજીનામા ધરી દીધા બાદ ગુરુવારે વડાપ્રધાન બોરિસ જોન્સને પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોન્સન વિરુદ્ધ તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવો થઈ ગયો હતો. તેમની સરકારના બે મંત્રી ઋષિ સુનક અને સાજિદ જાવેદ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મામલો થાળે પાડવા બોરિસે સ્ટીવ બાર્કલ અને નાદિમ જાહાવીને મંત્રી બનાવ્યા હતા પરંતુ તેનાથી વાત વણસી ગઈ હતી. બોરિસના નિણય સામે વધુ 39 મંત્રીઓએ રાજીનામા આપી ખુલ્લો બળવો કરતાં બોરિસ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આખરે તેમણે પણ બુધવારે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોન્સને રાજીનામું આપતા પહેલાં રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા બદલ દુઃખી છે. જોકે,



જ્યાં સુધી નવા વડાપ્રધાનની વરણી ન થાય ત્યાં સુધી જોન્સન હોદ્દા પર યથાવત રહેશે.

બ્રિટનમાં નવા વડાપ્રધાનની વરણીની અલગ વ્યવસ્થા છે. જો કે બોરિસ જોન્સન જ્યાં સુધી નવા પ્રધાનમંત્રીની પસંદગી ન થઈ જાય ત્યાં સુધી પદ પર યથાવત રહેશે. મીડિયાના જણાવ્યાં મુજબ ઓક્ટોબરમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી થશે. હાલ પીએમ પદની રેસમાં અનેક નામ ચર્ચામાં છે.

બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક સામેલ

લંડન

બ્રિટનમાં બોરિસ જોન્સનના રાજીનામાનો ધમધમાટ જોવા મળ્યો હતો. ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન પદની રેસમાં છે. જો તેઓ વડાપ્રધાન થશે તો ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન હશે. ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટિશ નેતા છે. તેમનો જન્મ 12 મે 1980ના રોજ સાઉથમ્પટન, હેમ્પશાયર, સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં



ભારતીય માતા-પિતા યશવીર અને ઉષા સુનકને ત્યાં થયો હતો. તેમના પિતા જનરલ ફિઝિશિયન હતા અને તેમની માતા ફાર્મસી ચલાવતા હતા. સુનકના દાદા-દાદીનો જન્મ ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો, તેઓ 1960ના દાયકામાં પૂર્વ આફ્રિકાથી બ્રિટનમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. ઋષિ તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. રિશીએ ટોચની કોલેજોમાંથી પણ અભ્યાસ કર્યો છે. સુનક વિન્ચેસ્ટર કોલેજ, લિંકન કોલેજ, ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુરમાં યાદ રાખશો
Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada

bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel
Cell: 647-502-8069
Fax: 416-253-9461

પાકિસ્તાનમાં વરસાદથી અનેક મકાનો જમીનદોસ્ત, 77નાં મોત

ઈસ્લામાબાદ

પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ૭૭ લોકોના મોત થયા છે. માત્ર બલુચિસ્તાન પ્રાંતમાં વરસાદના કારણે ૩૮ લોકોના મોત નોંધાયા છે. દેશના જલવાયુ પરિવર્તન મંત્રી શેરી રહેમાને વરસાદને કારણે થયેલા મૃત્યુને રાષ્ટ્રીય આફત ગણાવી હતી.



પાકિસ્તાનમાં થયેલા ભયંકર વરસાદના કારણે સેંકડો મકાનો ધરાશાયી થયા છે. મંત્રી રહેમાને જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

રહેવાની જરૂર છે. કારણ કે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં સરેરાશ વરસાદ કરતાં ૮૭ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અહેવાલ અનુસાર, મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, ભારે વરસાદને કારણે મૃત્યુ પામનારાઓમાં બાળકો, પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સરકાર રાષ્ટ્રીય અને પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓની મદદથી વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, પાણીનું સ્તર ઊંચું છે અને લોકોએ સાવચેત

મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રાષ્ટ્રીય મોનિટરિંગ લઈને યોજના તૈયાર કરી છે. તેમણે લોકોને સતર્ક રહેવાની પણ અપીલ કરી હતી જેથી કરીને વધુ જાન-માલનું નુકસાન અટકાવી શકાય. મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે, આ મૃત્યુ અને વિનાશને રોકવા માટે અમને વ્યાપક યોજનાની જરૂર છે. કારણ કે આ બધો વિનાશ જલવાયુ પરિવર્તનને કારણે થઈ રહ્યો છે.

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

માતાપિતા અને દાદા-દાદીના સુપર વિઝાની મુદત હવે પાંચ વર્ષની

સુપર વિઝામાં 4 જુલાઈથી નવા ફેરફારો અમલમાં આવ્યા: અનેક ઈમિગ્રન્ટ્સને સરકારના નિર્ણયથી લાભની આશા

ઓન્ટેરિયો

કેનેડામાં સુપર વિઝા એ કામચલાઉવિઝા છે, જેની મદદથી કેનેડીયન નાગરિકો અને પરમેનન્ટ રેસીડન્ટ્સ તેમના માતાપિતા અને દાદા દાદીને કેનેડા બોલાવી શકે છે. સુપર વિઝા મલ્ટી એન્ટ્રી વિઝીટર વિઝા છે જે ૧૦ વર્ષ સુધીના હોય છે. હવે આ સુપર વિઝામાં ત્રણથી જુલાઈથી અમલમાં આવે એવા સુધારા કરવામાં આવ્યા છે.

- » આ સુપર વિઝા ધારકોને કેનેડામાં દરેક પ્રવેશથી પાંચ વર્ષ સુધી રહેવાની પરવાનગી આપશે.
- » જેમની પાસે હાલમાં સુપર વિઝા છે તેમને પણ રોકાણ બે વર્ષ માટે વધારવા માટેની વિનંતી કેનેડામાં હોય ત્યારે કરી શકશે. એટલે કે હાલના સુપર વિઝા ધારકો કુલ સાત વર્ષ સુધી સતત રહી શકશે.
- » કેનેડાના ઈમિગ્રેશન મિનીસ્ટરને ઈન્ટરનેશનલ મેડીકલ ઈન્સ્યોરન્સ કંપનીઓને ભવિષ્યમાં સુપર વિઝાના અરજદારોને કવરેજ આપવાનો આદેશ કરવાની સત્તા છે.
- » જુના સુપર વિઝા ધારકને દરેક પ્રવેશ પછી બે વર્ષ રહેવાની છૂટ મળશે. વધારામાં માત્ર કેનેડીયન વીમા સુવિધા પુરી પાડનારા મેડીકલ વીમાની

સુવિધા આપી શકશે. (જે સુપર વિઝા ધારકને એની જરૂર હોય એને). આ સુધારાઓથી હવે માતા-પિતા અને દાદા દાદીને સતત પાંચ વર્ષ વિઝા તાજા કરાવવા વિના રહી શકશે. એનાથી વિઝાધારકો કેનેડા સિવાયના દેશની વિમા કંપની પાસેથી મેડીકલ ઈન્સ્યોરન્સ ખરીદી શકશે. કેનેડાના રાજકારણી કેલી સીબેકના કહેવા મુજબ તેમણે આ સુધારાનો પ્રસ્તાવ મુક્યો હતો જેથી વિદેશના મેડીકલ ઈન્સ્યોરન્સથી લોકોના દર વર્ષ હજારો ડોલર બચી શકશે. વધારામાં સીબેકે કહ્યું હતું કે, સરકાર વિદેશી વીમા કંપનીઓ ખર્ચની બાબતે ચોક્કસાઈ રાખશે. જેથી બિમાર સુપર વિઝા ધારકને રાહત થઈ શકે. સુપર વિઝાથી એ પેરન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ (પીજીપી)ના વિકલ્પ તરીકે કામ કરશે. જેનાથી કેનેડાના પરમેનન્ટ રેસીડન્ટ્સ માટે મદદ મળી શકશે.

ઓટાવા વિસ્તારમાં સલામતી માટે અપગ્રેડેશન સાથે ઈ-સ્કૂટર્સ તૈયાર

ઓટાવા

શરૂ કરી શકાય તેવા ઈ-સ્કૂટર્સ 2022માં મોડી શરૂઆત પછી ડાઉનટાઉન ઓટાવાની શેરીઓમાં પાછા આવી રહ્યા છે ત્યારે શહેરીજનોને આશા છે કે તેઓ વપરાશકર્તાઓ અને રાહદારીઓ બંને માટે વધુ સુરક્ષિત રહેશે. જે પાઈલોટ પ્રોજેક્ટને સિટી કાઉન્સિલે માર્ચમાં ત્રીજા વર્ષ માટે લંબાવ્યો હતો એ બેટરી સંચાલિત, GPS-સક્ષમ સ્કૂટર્સ ગયા વર્ષના મેના અંતમાં અને 2020ના જુલાઈના મધ્યમાં પોપ-અપ થયા હતા. એક સમાચારમાં જાણવા મળ્યું હતું કે, આ સિઝનમાં પાછા ફરવા માટે બે કંપનીઓને પસંદ કરવામાં આવી છે.

બર્ડ કેનેડા અને ન્યુરોન મોબિલિટી. લાઈમ ઈલેક્ટ્રિક સ્કૂટર્સ, ત્રીજી કંપની છે અને ઓટાવામાં કાર્યરત છે પણ એ આ વર્ષે પરત નહીં આવે. ન્યુરોન સ્કૂટર બુધવારે શહેરમાં આવશે, ત્યારબાદ આવતા અઠવાડિયે બર્ડ આવશે. શહેરના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ વર્ષનું લોન્ચિંગ અમુક પસંદગીના વિસ્તારોમાં થશે, પછી જો સલામતી વધારવા માટે રચાયેલી નવી સુવિધાઓ યોગ્ય રીતે કામ કરતી જોવા મળે તો અન્ય વિસ્તારોમાં પણ લોન્ચિંગ કરવામાં આવશે. હવે જો કોઈ નજીક આવી જશે ત્યારે લોકોને ચેતવણી આપવા ઈ-સ્કૂટર વિશિષ્ટ અવાજ કરશે.

જુનમાં વાહનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ૧૧.૫ ટકાનો ઘટાડો

વાહનોના ઓછા પુરવઠાને કારણે સ્થિતિ સર્જાઈ હોવાનું તારણ ટોરોન્ટો

ડેસરોઝીયસ ઓટોમોટીવ કન્સલ્ટન્ટ્સના જણાવ્યા મુજબ કેનેડામાં વાહનોના વેચાણમાં જુન માસમાં ઘટાડો નોંધાયો છે. જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૧૧.૫ ટકા જેટલો છે. જેનું મુખ્ય કારણ પુરવઠાની વ્યવસ્થા હોઈ શકે છે. એક અંદાજ મુજબ ૧૪૩૭૭૩ લાઈટ ઓટોમોટીવ વેચાણ જુનમાં થયું



જે ૨૦૦૯ની મંદી બાદનું આ સૌથી ઓછું હતું. વેચાણમાં જે ઘટાડો થયો છે એ નોંધપાત્ર છે કેમકે ગયા વર્ષે આ સમયમાં ૧૬૨૫૦૦ જેટલા વાહનો વેચાયા હતા. જ્યારે ૨૦૧૮માં એ આંક ૨૦૦૦૦૦ જેટલો હતો. ડેસરોઝીયસના મેનેજિંગ પાર્ટનર એન્ડુ કીંગે કહ્યું હતું કે, તૈયાર વાહનોની કમી

હોવાથી આ ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે બજારમાં પણ મંદીનો માહોલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાહનોના ઉત્પાદનમાં વપરાતી સેમીકંડક્ટર ચીપની તંગીને કારણે ઉત્પાદન ઓછું થતું હોવાથી પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ છે. કોવિડ મહામારી બાદ આ સમસ્યા વધી છે. જો કે, એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે કે વાર્ષિક વેચાણના આંકડાઓ પહેલા જેટલા થઈ શકે છે. જુન બાદ વેચાણ વધી શકશે. કેમ કે, મે માસમાં ૧.૩૬ મિલિયન વાહનો વેચાયા હતા અને જુનમાં એ આંક ૧.૪૫ મિલિયન સુધી પહોંચ્યો છે.

કેનેડિયન ઈન્ડિયન એસોસિએશન ઓફ હોલ્ટન રિજન દ્વારા, કેનેડાના સ્થાપના દિવસની ઉજવણી



ઓન્ટેરિયો

155મો કેનેડા દિવસ 2 જુલાઈ, 2022ના રોજ મિલ્ટન સ્પોર્ટ્સ ઈવેન્ટ એરિયા "A" ખાતે ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કેનેડિયન અને ભારતીય રાષ્ટ્રગીત ગાયા પછી, કેનેડિયન ઈન્ડિયન એસોસિએશન ઓફ હોલ્ટન પ્રદેશના પ્રમુખ જગમોહન મૈનરાએ કાર્યક્રમને સંબોધન કર્યું અને તમામ મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં 300થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી. પ્રથમવાર કેનેડા દિવસની ઉજવણી નિમિત્તે, મિલ્ટનના મેયર ગોર્ડન કાન્સલ, કાઉન્સેલર રિક ડી લોરેન્સો અને પ્રાદેશિક કાઉન્સિલર, માર્ક ક્લુએટ ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા.

બોર્ડ તેના પ્રેક્ષકોને કેનેડા અને ભારત વિશે રસપ્રદ તથો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. રેફલનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બહુવિધ વિજેતાઓ હતા. શોના અગ્રણીઓ નિક ઠક્કર, હેતલ શાહ, નિલેશ પટેલે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉત્તમ કામ કર્યું હતું. બિઝનેસ સ્પોન્સર્સ, સ્વયંસેવકો, પ્રમુખ જગમોહન

મૈનરા, નિલેશ પટેલ, નિક ઠક્કર, હસુ બિહારી સ્થાનકિયા, દિક્કશા પાલ નારાયણ, રોહિત શર્મા, જીગર પટેલ, હેતલ શાહ, શિખા ધીંગરા, અને શોના શર્માના અથાગ પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કેનેડિયન ઈન્ડિયન એસોસિએશન હોલ્ટન પ્રદેશમાં નોંધાયેલી બિન-લાભકારી સંસ્થા છે. જે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા, ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિની વધુ સારી સમજ વિકસાવવા અને આપણા લોકોને એક કરવા માટે વિવિધ ભારતીય સાંસ્કૃતિક સંગઠનો અને જૂથો વચ્ચે સેતુ તરીકે સેવા આપે છે. ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવું પણ તેનો ઉદ્દેશ્ય છે. એસોસિએશનમાં જોડાવા માટે તમામ ઈન્ડો-કેનેડિયનોનું સ્વાગત કરે છે.

બંને દેશના રાષ્ટ્ર ગીતનું ગાન કરાયું, કેનેડા અને ભારત વિશે રસપ્રદ તથો અંગે પ્રશ્નોત્તરી થઈ

આ સંગઠન વિશે વધુ માહિતી વેબસાઈટ www.canadianindianassociation.com પર મળી શકે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત નૃત્ય સ્વરૂપો જેમ કે કથક, ભરતનાટ્યમ, ઉડિયા પરફોર્મન્સ, ગરભા અને રાજસ્થાની નૃત્યો અને વિવિધ બોલિવૂડ ટેલેવિઝન કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

THINKING OF BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ ની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો. મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us TODAY for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.



MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX



Member of the Real Estate Board of Ontario (REBO)

CROSSROADS REALTY INC.

#SellwithABOWATH your Local REALTOR

*Not authorized to sell or buy under contract



લિબરલ તેમજ કન્ઝર્વેટિવ પાર્ટીને 2021માં 44 મિલીયન યુએસડીથી વધુનું દાન મળ્યું

એનડીપી અને ગ્રીન પાર્ટીએ હજુ ભંડોળ કે દાનની જાહેરાત કરી નહીં

ઓટાવા
કેનેડામાં વર્ષ 2021માં જો કોઈ વ્યક્તિએ વધુ દાન મેળવ્યું હોય તો તે કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા છે, જેણે 26.૪ મિલીયન યુએસડીનું દાન મેળવ્યું હતુ જે વર્ષમાં ચૂંટણી હતી અને એમાં એણે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈલેક્શન સેક્ષન કેનેડા સમક્ષ રજૂ કરાયેલા ઓડિટેડ સ્ટેટમેન્ટથી જાણવા મળે છે કે, પાર્ટીએ 2020માં ઉઘરાવેલા ભંડોળ કરતા એ ૬ મિલીયન વધુ દાન લોકોએ ટોરીઝ પાર્ટીને ૯૫૦૦ ડોલર આપ્યા હતા, જે અગાઉના વર્ષોની સરખામણીમાં ૫૦૦૦ ડોલર વધુ હતા. જસ્ટીન ટ્રુડોની

લિબરલ પાર્ટીને ૧૮.૧ મિલીયન મળ્યા હતા. જે ૭૫,૮૦૦ દાતાઓ તરફથી હતા અને એ ૨૦૨૦ની સરખામણીમાં ૩ મિલીયન ડોલર વધુ હતા. બંને પક્ષોએ ૨૦૨૧માં મોટી લોન પણ લીધી હતી. લિબરલ્સે છ ધિરાણકારો પાસેથી ૩૦ મિલીયન ડોલર લીધા હતા, જ્યારે કન્ઝર્વેટિવે ૨૯ મિલીયનની લોન લીધી હતી. જે ૨૦૨૨ની શરૂઆતમાં ચુકવી પણ દીધી હતી. ૫ બ્લોક ક્યુબેકોઈસે અડધા મિલીયનથી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. જે ૧૧,૩૦૦ ડોલર હતુ. બધુ મળીને ૨ મિલીયન સુધી પહોંચ્યું હતું. એનડીપી અને ગ્રીન પાર્ટીએ હજુ ભંડોળ

કે દાનની જાહેરાત કરી નથી. ૩૧મી ડીસેમ્બર, ૨૦૨૧ સુધીના ઓડિટેડ હિસાબોમાં ૩૬ દિવસના ચૂંટણી પ્રચારનો હિસાબ પણ હતો. જે ત્યારની લિબરલ સરકારના ઓગસ્ટથી ૨૦મી સપ્ટેમ્બર સુધીનો સમયનો હતો. બીજા વર્ષોની સરખામણીમાં આ વખતનો ચૂંટણી ખર્ચ પણ વધુ હતો. જાહેરાતો પાછળનો ખર્ચ પણ વધુ હતો. બ્લોક શેર્લીંગે ૧.૫ મિલિયન, કન્ઝર્વેટિવે ૮.૮ મિલીયન અને લિબરલ્સે ૧૫.૪૧ મિલીયનનો ખર્ચ કર્યો હતો. લિબરલ્સ અને ટોરીઝ ૫૦૦,૦૦૦ ડોલર આગળના વર્ષોમાં જાહેરાત પાછળ ખર્ચ્યા હતા.

પાલતુ પ્રાણીઓની કાર્ગો મુસાફરી પર એર કેનેડાએ લાઘો પ્રતિબંધ

ટોરોન્ટો

એર કેનેડાએ 12 સપ્ટેમ્બર સુધી તેની ફ્લાઈટ્સના બેગેજ કમ્પાર્ટમેન્ટમાં પાલતુ પ્રાણીઓને લઈ જવા માટેની નવી અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. એરલાઈને બુધવારે જણાવ્યું હતું કે, આને કારણે દેશભરના મોટા એરપોર્ટને મુસાફરીમાં વિલંબ, ફ્લાઈટ કેન્સલેશન અને લોજિસ્ટિકલ પડકારોનો સામનો કરવો પડે છે. મોટાભાગની ફ્લાઈટ્સની કેબિનમાં નાના પ્રાણીઓને મંજૂરી આપવામાં આવશે, જો તેઓ પેસેન્જરની સામેની સીટની નીચે કેરિયરમાં સૂઈ શકે. કેબિનમાં પાલતુ પ્રાણી લાવવા માટે કેનેડા અને યુ.એસ. (હવાઈ સિવાય)ની અંદરની ફ્લાઈટ્સ માટે 50 ડોલર અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે 100 ડોલરનો ખર્ચ થશે.

એર કેનેડાએ મીડિયાના પ્રશ્નોના જવાબમાં ઈમેઈલ દ્વારા જણાવ્યું હતું કે, “હાલના એરપોર્ટ વિલંબને કારણે, પાલતુ પ્રાણીઓની સલામતી અને સુવિધા અંગે મુશ્કેલી છે. તેથી અમે 12 સપ્ટેમ્બર, 2022 સુધી લગેજ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા પાલતુ પ્રાણીઓ માટેની નવી અરજીઓ સ્વીકારીશું નહીં.” એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આનાથી તાલીમ આપેલાં પ્રાણીઓ અથવા કેબિનમાં મુસાફરી કરતા નાના પાલતુ પ્રાણીઓને અસર થતી નથી,” ટ્રેકિંગ સેવા ફ્લાઈટઅવરના જણાવ્યા અનુસાર, મંગળવારે ઓછામાં ઓછા ચોથા દિવસે સૌથી વધુ ફ્લાઈટના સંચાલનમાં વિલંબ થયો હતો. તેથી હવે એર કેનેડા વિશ્વની મુખ્ય એરલાઈન્સની યાદીમાં નંબર વન હોવાથી નવા ફેરફાર આવ્યા છે.

‘કાલી’ ડોક્યુમેન્ટ્રી વિવાદ : પ્રસારણ બદલ કેનેડાના મ્યુઝિયમે માફી માગી

મ્યુઝિયમે હવે પછી ફિલ્મ પ્રસારિત નહીં કરવા નિર્ણય કર્યો



ઓન્ટેરિયો
કાલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો પોસ્ટર વિવાદ સતત નવા વળાંક લઈ રહ્યો છે. ફિલ્મ મેકર લીના મણિમેકલઈ તરફથી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટર શેર કર્યા બાદથી જ ખૂબ વિવાદ થઈ રહ્યો છે. જેમાં હિંદુ દેવીને સિગારેટ પીતા અને હાથમાં એલજીબીટીના ધ્વજ સાથે બતાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ઉઠેલા વિવાદ બાદ આ મુદ્દો દેશના જુદા-જુદા રાજ્યોમાં સ્ટેશન સુધી પહોંચી ગયો છે. દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ મેકર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. હવે આ મામલે કેનેડાના મ્યુઝિયમે પણ મોટું પગલું ઉઠાવ્યું છે. ફિલ્મ નિર્માતા નિર્દેશક લીના મણિમેકલઈએ ભલે અત્યાર સુધી પોસ્ટરને મુદ્દે માફી ના માગી, પરંતુ કેનેડાના જે મ્યુઝિયમમાં આ ફિલ્મ બતાવાઈ હતી, તે મ્યુઝિયમે માફી માગી છે. કેનેડાના ટોરન્ટો શહેરના આગા ખાં મ્યુઝિયમમાં આ ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત

કરવામાં આવી હતી. હવે આ મ્યુઝિયમે માન્યુ છે કે, તેમણે હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારી ફિલ્મનું પ્રદર્શન કર્યું છે, જે ખોટું છે. આગા ખાં મ્યુઝિયમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમને ખેદ છે કે અંડર ધ ટૅટ પ્રોજેક્ટ હેઠળ મ્યુઝિયમમાં પ્રસ્તુત 18 શોર્ટ વીડિયો તરફથી સોશિયલ મીડિયા ઉપર જારી પોસ્ટ હિંદુ અને અન્ય ધાર્મિક સમુદાયોને અજાણતા અપમાનિત કર્યા છે. હવે આ ફિલ્મનું આ મ્યુઝિયમમાં પ્રસ્તુતીકરણ કરવામાં આવશે નહીં. મ્યુઝિયમ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સંગ્રહાલયનું મિશન કલાના માધ્યમથી અલગ-અલગ સંસ્કૃતિઓ વચ્ચે સમજ અને સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ ધાર્મિક અભિવ્યક્તિઓ અને આસ્થા સમુદાયોનું સન્માન તે મિશનનું એક અભિન્ન અંગ છે. મ્યુઝિયમમાં હવે ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવશે નહીં.

ઓન્ટેરિયોમાં વયસ્કોને કોવિડ રસીનો ચોથો ડોઝ સત્વરે આપવા ડોક્ટરોની ભલામણ

7.4 મિલીયનને પહેલો બુસ્ટર ડોઝ અપાયો : ડોઝની અસર ચાર મહિના બાદ ઓછી થઈ જાય છે


ઓન્ટેરિયોમાં કેટલાક ડોક્ટરોએ સરકારને તાકીદ કરી છે કે તમામ પુખ્તવયના નાગરિકોને કોવિડ-૧૯ના બુસ્ટર ડોઝનો બીજો ભાગ તત્કાળ આપવાનું શરૂ કરવું આવશ્યક છે. ઓન્ટેરિયોના પબ્લિક હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૭.૪ મિલીયન ઓન્ટારિયનને પહેલો બુસ્ટર ડોઝ અપાયો છે. જે પૈકીના ૯૦ ટકા ડોઝ છેલ્લા પાંચ મહિનામાં આપવામાં આવ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-૧૯ના બુસ્ટર ડોઝની અસર ચાર મહિના બાદ ધીમે ધીમે ઓછી થતી હોય છે. જેને પગલે હવે ઓન્ટેરિયોમાં બીજા બુસ્ટર ડોઝની માંગ વધવા માંડી છે. આ અંગે ડો. નીલી કેપલાન મર્થે કહ્યું હતું કે, બુસ્ટર ડોઝની અસર ખાસ કરીને ગંભીર બિમારીઓ વાળા કેસમાં ઓછી થતી જાય છે. જે ગંભીર બાબત છે અને એટલે જ અમે સરકારને વિનંતી કરી છે કે, બીજો બુસ્ટર ડોઝ આપવાનું ઝડપથી શરૂ કરે. ઓન્ટેરિયોમાં હાલ ૬૦ વર્ષથી વધુ વયના લોકોને જ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો તમામ પુખ્તવયનાઓને પણ બુસ્ટરનો બીજો ડોઝ આપવામાં આવે તો એની અસરકારકતા વધી શકે છે. હાલના ધોરણો મુજબ ૧.૪ મિલીયન લોકો જ બુસ્ટર માટે લાયક ગણાય અને ૬ મિલીયન લોકો જેમણે ગયા શિયાળામાં પહેલો ડોઝ લીધો હતો એ આમાંથી બાકાત રહી જાય છે. મીડિયાએ આ વિશે ગયા અઠવાડિયે મિનીસ્ટ્રી ઓફ હેલ્થને પુછ્યું હતું કે, ઓન્ટેરિયોમાં અત્યારે બુસ્ટર



ડોઝની ઉપલબ્ધતા કેટલી છે પણ અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. નેશનલ એડવાઈઝરી કમિટી ઓન ઈમ્યુનાઈઝેશન (એનએસીઆઈ)એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, જે લોકો જોખમી લેવલમાં હોય તેમને પ્રાંતમાં બીજો બુસ્ટર ડોઝ અપાઈ જવો જોઈએ. એમાં એમણે અગાઉ કેટલા ડોઝ લીધા છે એ જોયા વિના વધારાનો ડોઝ અપાવો જોઈએ. સમિતિએ તો ૧૨ વર્ષથી ૬૪ વર્ષ સુધીનાઓને આ ડોઝની ભલામણ કરી છે. જો કે ઓન્ટેરિયોના સત્તાવાળાઓ તરફથી એવા કોઈ સંકેત નથી કે ચોથા ડોઝ માટેની પાત્રતા અંગેની માર્ગદર્શિકામાં કોઈ ફેરફાર થશે કે નહીં. આરોગ્યવિભાગના પ્રવક્તાએ મીડિયાને ઈ-મેલથી જણાવ્યું હતું કે અમે સમિતિની ભલામણોની સમીક્ષા કરી રહ્યા છીએ અને પાનખર સુધીમાં કેટલા બુસ્ટર ડોઝ ઉપલબ્ધ થશે એની જાણકારી આપીશું.

ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની બેઠક, કાર્યક્રમોની જાહેરાત

મિસીસાગા
ગુજરાતી સિનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની એક બેઠક હેઝલ, મેકકેલીન હોલ, વીક, જોન્સ સન કોમ્યુનિટી સેન્ટર ખાતે ગત રવિવારે મળી આવી હતી. બેઠકમાં મીનલબેન પટેલ અને અનસુયાબેન ટેલર હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કલાબેન પટેલે આવકારવિધિ કર્યા બાદ દિવંગત ગીરીશભાઈ મહેતા અને નિરંજનાબેન પટેલને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમણે સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે જણાવ્યું હતું કે, સંસ્થાએ Punta Cana, Dominican Republic TRIP માટે પંદરસો ડોલરનો પ્રત્યેક સભ્યનો ખર્ચ નક્કી કર્યો છે. આ ટુર 17મી ઓગસ્ટથી 24 મી ઓગસ્ટ સુધી સાત દિવસ રહેશે. 28 ઓગસ્ટના રોજ લેક ફ્રન્ટ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની ફી ૨૦ ડોલર લેવામાં આવશે. ટ્રિલિયન હેલ્થ ફાઉન્ડેશન ખાતે 11મી સપ્ટેમ્બર સ્પોન્સરશિપ અને વોકથોન તથા ડોનેશનનો કાર્યક્રમ યોજાનારા છે. તે જ દિવસે સવારે 11 કલાકે તે જ સ્થળે પિકનિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ



ઉપરાંત ઓક્ટોબરની બીજી તારીખે સવારે 10 થી 3 વાગ્યા સુધી સગન બેન્કવેટ હોલમાં દિવાળી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સપ્ટેમ્બરની ૧૮ થી 22 તારીખ સુધી ડોર સેટ કેમ્પ યોજવામાં આવ્યો છે. જે બાદ ઈલાબેન દેવાનીએ તમામ સભ્યોને બોલી ફ્રિટ ડાન્સ કરાવી ખૂબ જ આનંદ અપાવ્યો હતો. કલાબેને સ્ટેજ પર આવી હૃદયસ્પર્શી ભજન ગાયું હતુ. આ સાથે પ્રેક્ષકોએ પણ ગાવાનો લાભ લીધો હતો. ઉપપ્રમુખ પ્રવીણભાઈ મહેતાએ કહ્યું હતુ કે, દિવાળીના કાર્યક્રમમા કોઈને પણ સહભાગી બનવું હોય તો તે અંગે અગતરી જાણ કરવી. બિન્ગો ગેમ કનુભાઈ પટેલ અને શ્રી સુરેન્દ્રભાઈ સોમૈયાએ રમાડી હતી.

SUPER VISA MEDICAL INSURANCE

VISITOR TO CANADA INSURANCE

Up to 45% DISCOUNT with deductible

LIFE INSURANCE

MORTGAGE /LINE OF CREDIT INSURANCE

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 8.00	\$ 12.00	\$ 11.00	\$ 18.00	\$ 20.00	\$ 27.00
40 Yrs	\$ 11.00	\$ 15.00	\$ 14.00	\$ 21.00	\$ 25.00	\$ 36.00
50 Yrs	\$ 25.00	\$ 35.00	\$ 32.00	\$ 45.00	\$ 60.00	\$ 85.00
60 Yrs	\$ 60.00	\$ 80.00	\$ 107.00	\$ 150.00	\$ 190.00	\$ 236.00

Rates Quotes are Preferred Plus Non Smoker Term 10 With Medical Test & Rates are Subject to Change.

- NO MEDICAL TEST LIFE INSURANCE (વ્યાં સુધી કે તમને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કેન્સર હોય અથવા બીજી કોઈ કંપની દ્વારા તમામ ઇન્સ્યોરન્સને ડિક્લારેશન કર્યું હોય)
- LIFE INSURANCE FOR REFUGEES, STUDENTS, KIDS, ON WORK PERMIT
- GURANTEED MONEY BACK (Life, Critical Illness & Disability Insurance)
- Corporate owned Life and Critical Insurance
- Key Person Insurance • RRSP • RESP • TFSA

(up to age) 85

Davinder Singh Chawla
TOLL : 1866.623.0865

Call For HONEST ADVICE 416.320.4614

www.financialhuttttd.co Email : - Davindersinghfh@gmail.com

તંત્રી સ્થાનેથી

બ્રિટન સરકારમાં બળવા પાછળ જોન્સનની નિષ્ફળતા કારણભૂત

બ્રિટનના બોરિસ જોન્સન કેટલાક સમયથી કોઈને કોઈ વિવાદમાં ફસાતા રહ્યા હતા. આખરે ચાલુ સપ્તાહે બોરિસની સરકારના ફાઈનાન્સ અને હેલ્થ મિનિસ્ટરે રાજીનામું આપતા સરકારના કારભાર સામે સવાલો ઉઠ્યા હતા. આ સાથે જ બ્રિટનમાં કંઈક નવાજૂની થાય એવી શક્યતા દેખાવા માંડી હતી. આખરે જોન્સને પણ ગુરુવારે રાજીનામું ધરી દેતા બ્રિટનમાં સત્તા પરિવર્તન આવ્યું છે. જોન્સન માટે


 તંત્રી - પ્રકાશક
 સ્વદેશ

સર્જાયેલી આ સ્થિતિ માટે તેમની ખુદની નીતિઓ અને નિષ્ફળતા જવાબદાર મનાય છે. જ્યારથી બોરિસની સરકાર બની ત્યારથી કિસ પિંચરના કરતૂતો ચર્ચાતા રહ્યા છે.

બોરિસ જોન્સનના મંત્રીમંડળના બળવાના કેન્દ્રમાં કિસ પિંચર નામની વ્યક્તિ છે. આ એ જ વ્યક્તિ છે જેના પર યૌન શોષણનો આરોપ છે. આવી વ્યક્તિને જોન્સને ફેબ્રુઆરી મહિનામાં ડેપ્યુટી ચીફ ઓફિસ તરીકે નિયુક્તી કરી હતી. 29 જૂનના રોજ લંડનના પિકાડેલીમાં કાર્લટન ક્લબમાં પિંચરના ગેરવર્તનની બે ફરિયાદ ધ્યાનમાં આવી હતી. જેમાં બે પુરુષોએ પિંચર પર દારુના નશામાં આપત્તિજનક રીતે સ્પર્શ કરવાનો આરોપ મુક્યો હતો. આ અંગે જોન્સન પર દબાણ વધતા પિંચર ને ડેપ્યુટી ચીફ ઓફિસના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

જે પછી વડાપ્રધાન બોરિસ જોન્સને માફી માંગી અને એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે, પિંચરની વરણી એ મારી ભૂલ હતી. બોરિસે માફી માંગી લેતા મામલો ઠંડો પડી જશે એમ મનાતું હતું. પરંતુ તેમ થયું નહીં, કોરોનાકાળમાં સર્જાયેલી સ્થિતિમાં પણ બોરિસ નબળા પુરવાર થયા હતા. કોરોનાને નાથવામાં કેટલાંક ખોટા અને ઉતાવળિયા નિર્ણયો લીધા હોવાના આક્ષેપો તેમની સામે થયા હતા. લોકડાઉનના સમય દરમિયાન જ તેમણે પોતાના નિવાસ સ્થાને જોરદાર પાર્ટી કરી હતી. વડાપ્રધાને જ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા આખા દેશમાં બોરિસના રાજીનામાની માંગણી ઉઠી હતી. બોરિસે એ વખતે પણ માફી માંગવાની નોબત આવી હતી.

આ વખતે બ્રિટનમાં ઋષિ સુનકે યુકેના નાણાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ બોરિસ જોન્સનની સરકારમાંથી રાજીનામાનો ધમધમાટ જોવા મળ્યો હતો. ઋષિ સુનકની જગ્યાએ નાદિમ જાહાવીને નાણાં પ્રધાન અને સાજિદ જાવેદની જગ્યાએ સ્ટીવ બાર્કલેની નિમણૂક કરીને જોન્સને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. ઉલ્ટું, ઋષિ સુનક અને સાજિદ જાવેદના આક્ષેપો બાદ બોરિસના મંત્રીમંડળમાંથી 24 કલાકથી ઓછા સમયમાં એકસાથે 39 મંત્રીઓ અને સંસદીય સચિવોના રાજીનામા પડી ગયા. કંઝર્વેટિવ પાર્ટીના ઉપાધ્યક્ષ બિમ અફોલામી, ટ્રેડ એમ્બેસેડર એન્ડ્ર્યુ મોરિસન, બોરિસના સહયોગી જોનાથન ગુલિસ અને સાકિબ ભાટીએ પણ રાજીનામું આપતા બોરિસની મુશ્કેલી વધી હતી.

આ પહેલાં જ ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શોપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓએ બુધવારે પીએમને મળીને પાર્ટીમાં સર્જાયેલી સંકટની સ્થિતિથી તેમને વાકેફ કર્યા હતા. આખરે પરિસ્થિતિ સમજી ગયેલા બોરિસ જોન્સને ગુરુવારે સવારે વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું હતું. આ પહેલાં બ્રિટનમાં ભારતીય મૂળના નાણાં પ્રધાન ઋષિ સુનક અને પાકિસ્તાની મૂળના સ્વાસ્થ્ય પ્રધાન સાજિદ જાવેદ રાજીનામું આપી બોરિસ જોન્સન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બોરિસની નીતિઓ વિશે ઋષિ સુનકે કહ્યું હતું કે, બોરિસના નેતૃત્વ ઉપર કોઈ

વિશ્વાસ રાખી શકાય તેમ નથી. તેથી સરકારમાંથી ખસી જવાનો અમારો નિર્ણય અમે અમલમાં મુક્યો છે.

જોન્સન સરકારમાંથી બે પ્રધાનોએ રાજીનામા આપતા જ વિપક્ષ લેબર પાર્ટીના નેતા કીર સ્ટર્મેરે એવું કહ્યું કે, દેશમાં આખેઆખી સરકાર જ બદલવાની જરૂર છે. કીરે ઉમેર્યું કે, અમે તો ચૂંટણી માટે પણ તૈયાર છીએ. બ્રિટનમાં નેક્સ્ટ ઈલેક્શન 2024માં થવાનું છે. આમ છતાં બોરિસ જોન્સનની પાર્ટીના નેતાઓ જ કહેવા માંડ્યા હતા કે, બોરિસે સત્તા છોડી દેવી જોઈએ. નેતાઓનો આક્ષેપ હતો કે, બોરિસ સરાજાહેર જુદું બોલવા માંડ્યા છે. કંઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય કિસ પિંચર પર યૌન શોષણના આક્ષેપો થયા હતા.

બ્રિટનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઋષિ સુનકનું નામ પણ વડાપ્રધાનની રેસમાં આગળ મનાય છે. આ ઉપરાંત વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ, જેરેમી હંટ, સંરક્ષણ પ્રધાન બેન વાલેસ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પેની મોરડેન્ટ અને ઋષિ સુનકની જગ્યાએ જેમને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા એ નાદિમ જાહાવીના નામો ચર્ચામાં છે.

UKના રાજકારણમાં ભારતીયનો દબદબો હોવાનું જગજાહેર છે. ઋષિ સુનક ભારતીય મૂળના બ્રિટિશ નેતા છે. તેમનો જન્મ 12 મે 1980ના રોજ સાઉથમ્પટન, હેમ્પશાયર, સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં ભારતીય માતા-પિતા યશવીર અને ઉષા સુનકને ત્યાં થયો હતો. તેમના પિતા જનરલ ફિઝિશિયન હતા અને તેમની માતા ફાર્મસી ચલાવતા હતા. સુનકના દાદા-દાદીનો જન્મ ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો, તેઓ 1960ના દાયકામાં પૂર્વ આફ્રિકાથી બ્રિટનમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. ઋષિ તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. રિશીએ ટોચની કોલેજોમાંથી પણ અભ્યાસ કર્યો છે. સુનક વિન્ચેસ્ટર કોલેજ, લિંકન કોલેજ, ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

અંગત જીવનની વાત કરીએ તો, ઋષિએ ઓગસ્ટ 2009માં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ઋષિ અને અક્ષતાને બે દીકરીઓ છે. અક્ષતા ભારતીય અભિજોપતિ એન.આર. નારાયણ મૂર્તિની પુત્રી છે. તે કટમરૈન વેન્ચર્સમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. તેને પોતાનું ફેશન લેબલ પણ છે અને બ્રિટનની સૌથી ધનિક મહિલાઓમાંની એક છે. 42 વર્ષીય ઋષિ સુનકને ફેબ્રુઆરી 2020માં બોરિસ જોન્સન દ્વારા તેમની સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમને નાણાકીય વિભાગની જવાબદારી મળી હતી. તે ઘણીવાર પૂર્વ સંરક્ષણ મંત્રી પેની મોરડેન્ટ સાથે જોવા મળે છે. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, ઋષિએ વેપારીઓ અને જરૂરિયાતમંદોને કેટલાક અબજ પાઉન્ડનું પેકેજ આપીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

ઋષિ ડ્રીન્ક કરતા નથી. પરંતુ કોવિડ 19 નિયમોના ઉલ્લંઘનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ઉપર પાર્ટીમાં હાજરી આપવા બદલ તેને દંડ ભરવો પડ્યો હતો. હવે જો ઋષિ સુનક બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે. જો આમ થશે તો તેઓ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન હશે. આ ઉપરાંત અન્ય એક દાવેદાર નાદિમ જાહાવી મૂળ ઈરાકના છે. ઈરાકના ભૂતપૂર્વ શાસક સદામ હુસેનના અત્યાચારોથી બચવા માટે નાદિમના પિતા પરિવાર સાથે ઈરાક છોડીને 1978માં બ્રિટન આવી ગયા હતા. એ સમયે નાદિમના ઉંમર માત્ર 11 વર્ષની હતી. ઋષિ, સાજિદ સહિતના જે લોકોએ બોરિસની વિરુદ્ધમાં મોરચો માંડ્યો એ બધાએ જ એક સમયે બોરિસને સાથ આપ્યો હતો, પણ બોરિસ પાસેથી તેમને જે અપેક્ષાઓ હતી એ પૂરી થઈ નથી.

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926

Government Licensed Structural Exterminator



DIVINE YOGA



By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join-today-on-ZOOM!

 : Classes Available :
 One to One Individual
 and Therapeutic

Geeta Tailor

416-456-2261

 Contact Geeta at
 divineyogabygeeta@gmail.com
 IG & FB: @divineyogabygeeta


યાત્રાધામ અંબાજીમાં કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મહામેળો

યોજાનાર મેળામાં દર્શનાર્થીઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરાશે

પાલનપુર

અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો જોકે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી જ તૈયારીઓ ધરવામાં આવી છે શ્રદ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું કે, બે વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો



પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે તે માટે કાળજીપૂર્વક કામગીરી કરવામાં આવશે બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, સ્વચ્છતા, મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

વિસનગરના ઉમતા પાસે નદીના પટમાં ગળે ફાંસો ખાઈ પ્રેમીપંખીડાનો આપઘાત

મહેસાણા

વિસનગર તાલુકાના ઉમતા નજીક રવિવારે વહેલી સવારે નદીના પટમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. વિસનગર તાલુકા પોલીસે કરેલી તપાસમાં વડનગર તાલુકાના સુંઢીયા ગામની યુવતી વિસનગરની એસ.કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું તેમજ મૂળ ઈન્દોરનો યુવક વિસનગરની ગેરેજમાં કામ કરતો હતો. શનિવારે યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને નીકળી હતી. રવિવારે સવારે તેની લાશ મળી હતી.

ઉમતા ગામ નજીક ઝાડ સાથે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવક મૂળ ઈન્દોરનો અને યુવતી સુંઢીયા ગામની હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત કરનાર મૂળ ઈન્દોરનો વતની ૨૪ વર્ષિય જીતેન્દ્ર બાબુલાલ શર્મા ઉમતા ખાતે તેની બહેન સાથે રહેતો હતો અને વિસનગરની ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે સુંઢીયા ગામની પાયલબેન કિશોરજી ઠાકોર વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં આર્થોપીડીકનો અભ્યાસ કરતી હતી.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial
24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

- 1 Spray Services
- 2 Fogging Services
- 3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special
રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા કચોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી (with sweet & Farsan) \$9.00 +Tax	Limited થાળી (without sweet & Farsan) \$7.50 +Tax
---	--

CATERING SPECIAL
\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber



Franchise Opportunity in GTA

Call us for details

રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪
૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

ઠાસરાના અમૃતપુરામાં કાળોતરો સાપ ડંખ મારી જતાં બે સગી બહેનના મોત

ઠાસરા

ઠાસરા તાલુકાના અમૃતપુરા સીમ વિસ્તારમાં રહેનાર એક પરિવારની બે દીકરીઓનું સાપ કરડી જવાને કારણે મોત નિપજતાં ગામમાં માતમ છવાયું છે. મંગળવારે રાત્રે ખાટલામાં ઉઘી રહેલી બંને બહેનોને કાળોતરો સાપે ડંખ મારતા સારવાર મળે તે પહેલા જ એક પછી એક બંને માસૂમ બાળાઓનું ઘરમાં જ મોત નિપજ્યું હતું. ચોમાસાની સીઝનમાં સાપ સહિતના ઝેરી સરિસૃપ બહાર આવવાની ઘટનાઓ વધી જાય છે. ઝેરી સાપ દ્વારા મનુષ્યોને ડંખ મારવાના કિસ્સા



પણ સામે આવે છે. ઠાસરા તાલુકાના અમૃતપુરા ગામ ખાતે બનેલા એક બનાવમાં સીમ વિસ્તારમાં ખાટલામાં ઉઘી રહેલી બે સગી બહેનોને કાળોતરો સાપે ડંખ મારતા બંનેનું મોત નિપજ્યું હતું. સીમ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ જયંતિભાઈ ગોહિલની બે નાની દીકરી લક્ષ્મી (ઉ.વ.૯) અને

સાવિત્રી (ઉ.વ.૧૧)એ આ ગોઝારા બનાવમાં પોતાનો જીવ ગૂમાવ્યો હતો. મંગળવારે રાત્રે અંદાજે ૧૧.૩૦થી ૧૨ વાગ્યાના અરસામાં આ બંને બહેનો ખાટલામાં ઉઘી રહી હતી. તે સમયે એકાએક ક્યાંકથી એક ઝેરી કાળોતરો સાપ ચઢી આવ્યો હતો અને સાપે બંને દીકરીઓને ડંખ માર્યો હતો. સાપના ડંખને કારણે બંને દીકરીઓએ કાગરોળ મચાવી હતી. જોકે પરિવારના સભ્યો દીકરીઓને સમયસર સારવાર માટે દવાખાને પહોંચાડી શકે તે પહેલા જ બંને બહેનોએ જીવ છોડી દીધો હતો.

આણંદમાં મંત્રીએ આપેલી સાડી અને ધાબળા લોકોએ પાછા આપી બહિષ્કાર કર્યો

આણંદ

આણંદ જિલ્લામાં મોસમનો પ્રથમ વરસાદ વેરી બન્યો છે. જિલ્લા પ્રભારી અને મહેસૂલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સોવારે બોરસદ તાલુકાની મુલાકાત લીધી હતી. બોરસદ, કઠોલ અને સીસ્વા ગામના મૃતકોને મહેસૂલ મંત્રીના હસ્તે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રીની બોરસદ ખાતેની મુલાકાત બાદ બોરસદના વનતળાવ વિસ્તારમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને તંત્ર દ્વારા વિતરણ કરાયેલ સાડીઓ પરત આપવા ઢગલો ખડકી દેતા મામલો ગરમાયો હતો. પોલીસના વર્તનને લઈને પણ સ્થાનિક નાગરિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

લુણાવાડાના ભાજપ નેતાનો પુત્ર દારૂની ૩૯ બોટલો સાથે ઝડપાયો

મહિસાગર

મહિસાગર જિલ્લાના લુણાવાડાના પૂર્વ વિધાનસભ્યનો પુત્ર દારૂની ૩૯ બોટલો સાથે ઝડપાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લુણાવાડા બેઠકના પૂર્વ કોંગ્રેસી વિધાનસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા હીરાભાઈ પટેલના પુત્રએ ખાનપુર તાલુકાના વડાગામમાં એક વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો અને જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે સ્થળ પર 'MLA ગુજરાત' લખેલી એક કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

હીરાભાઈના પુત્ર મહર્ષિ પટેલનો કોઈ બાબતે વડાગામમાં જસવંત પટેલ સાથે

ઝગડો થયો હતો. સોમવારે સાંજે મહર્ષિ પટેલ શુભમ મહાજન નામના શપ્સ સાથે જસવંત પટેલના ઘરે આવ્યો હતો. પહેલા તો તેમણે જસવંત પટેલને ફોન પર ધમકી આપી હતી અને પછી નશાની હાલતમાં તેમના ઘરે આવ્યા હતા. જેને લઈને જસવંત પટેલે પોલીસને ફોન કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ડેશબોર્ડ પર 'MLA ગુજરાત' લખેલી તકતીવળી એક SUV કાર મળી હતી. કારની તપાસ કરતાં પોલીસને સ્કોય વ્હિસ્કીની બોટલ અને અન્ય આલ્કોહોલિક પીણાંની બોટલો મળી આવી હતી. કારમાંથી કુલ ૩૯ દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે.

MS યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ પણ ભણાવાશે, ૬૦ બેઠકો સાથે કોર્સ

વડોદરા

દેશમાં હિન્દુત્વના મુદ્દાને લઈ રાજકીય પક્ષોમાં ઘમાસાણ મચી રહ્યું છે. તેવામાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે. એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની મંજૂરી સિન્ડિકેટની બેઠકમાં આપવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિન્દુત્વનો ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવશે. એમ એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીમાં


હિન્દુત્વનો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ હિન્દુત્વ પર હવે બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવી શકશે. ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી કોર્સની શરૂઆત કરવામાં આવશે. જેમાં ૬૦ બેઠકો સાથે કોર્સને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

આ અભ્યાસક્રમમાં ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, યોગ, વેદ પુરાણ, ઉપનિષદ અને આયુર્વેદનો સિલેબસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે અને હિન્દુ મૂલ્યોની સ્થિતિને સ્પષ્ટ કરશે.

કૂવામાં પડેલા ઢોરને કાઢવા ઉતરેલા જમાઈનું ડૂબી જતાં મોત, મૃતદેહ મળી આવ્યો

વડોદરા

વડોદરાના ડેસર તાલુકાના વેજપુર ગામે કૂવામાં પડેલા ઢોરને બચાવવા ઉતરેલા જમાઈનું ડોરનું તૂટી જતાં ડૂબી જવાથી મોત થયું છે. વાંટા ફળિયામાં રહેતા વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કૂવામાં ગઈકાલે બપોરે ઉદાભાઈ પરમારની માલિકીનું ઢોર કૂવામાં ખાબકતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. પરંતુ તેમના પ્રયાસો સફળ નહિ થતાં ઉદાભાઈના પત્નીએ તેમની પુત્રીને જાણ કરી હતી. જેથી પંચમહાલના એરોલ ગામેથી તેમના જમાઈ રાજુભાઈ મંગળભાઈ પરમાર (૩૮) અને તેનો સાળો પીન્ટુ વેજપુર આવી પહોંચ્યા હતા કૂવામાં બે ત્રણ દિવસ પહેલા એક ભૂંડ પડીને મરણ પામ્યું હોવાથી અસહ્ય દુર્ગંધના કારણે ઉભું રહેવાય તેવી પણ સ્થિતિ ન હતી.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora

Rajesh Khurana
Broker

સુરતમાં રખડતા કુતરાએ સાડા ચાર વર્ષમાં ૪૨ હજાર લોકોને બચકા ભર્યા

માન દરવાજા અને ખ્વાજા નગરમાં કુતરાએ 7 બાળકો સહિત 12ને બચકા ભર્યા

સુરત

સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે છેલ્લા સાડા ચાર વર્ષમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુતરાએ બચકા ભર્યા બાદ ૪૧,૮૬૪ વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. શહેરના માનદરવાજા, રાંદેર, અડાજણ, નાનપુરા, કતારગામ, વરાછા, સહિતના વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા



વ્યક્તિઓની પાછળ દોડીને કુતરા બચકા ભરે છે. જોકે વર્ષ ૨૦૧૯માં ૧૧૦૯૯ વ્યક્તિઓને, ૨૦૨૦માં ૭૧૨૪ વ્યક્તિઓને કુતરાએ બચકા ભર્યા હોવાથી સિવિલમાં આવ્યા હતા. શહેરમાં કોરોના

કેસ ઘટાડો થતા કુતરાઓ ફરી આંતક મચાવવા લાગ્યા છે. જોકે વર્ષ ૨૦૨૨માં જાન્યુ. થી જુન સુધીમાં ૫૫૪૮ વ્યક્તિને કુતરા બચકા ભર્યા હોવાથી સિવિલમાં હડકવા વિરોધી રસીમાં મુકાવવા આવ્યા હતા. સુરતમાં રખડતા કુતરાઓ ત્રાસ વધી રહ્યો છે. તેવા સમયે માનદરવાજા અને ખ્વાજાનગરમાં આજે સવારે રખડતા કુતરાએ વારા ફરતી ૭ બાળકો સહિત ૧૨ વ્યક્તિઓ બંચકા ભર્યા હતા. જોકે કુતરાના આતંકના લીધે ત્યાં રહીશોમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી.

જેલમાં બેઠા બેઠા કુખ્યાત સજ્જુ કોઠારીની જમીન દલાલને ધમકી

સુરત

અડાજણ પાટીયાના ધનમોરા કોમ્પ્લેક્ષ સામે ફીરદોશ ટાવરમાં રહેતા જમીન દલાલ સોહેલ અહમદ મનસુર (ઉ.વ. 40) એ ઉઘીના લીધેલા 2.50 કરોડ પરત આપી દીધા હોવા છતા ગુજસીટોક હેઠળના ગુનામાં જમીન પર છુટેલા માથાભારે સજ્જુ કોઠારીએ પુનઃ ઉઘરાણી શરૂ કરી હતી. સજ્જુએ સોહેલને ધમકી આપી હતી કે તેરા ફેસલા કર દુંગા, પહેલે મારા થા વો ભુલ ગયા, નહીં તો વાપસ યાદ કરવાના પડુંગા. આ ગુના ઉપરાંત પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જવા સહિતના ગુનામાં સજ્જુ હાલ લાજપોર જેલમાં

કેદ છે. પરંતુ જેલમાં બેઠા બેઠા પણ સજ્જુએ ખંડણી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે. સજ્જુ વિરુદ્ધ ફરીયાદ નોંધાવનાર સોહેલ ગત એપ્રિલ મહિનામાં પરિવાર સાથે ઘરે હતો ત્યારે મધરાતે સજ્જુનો ભાઈ આરીફ કોઠારી, અસગર બાગવાલા, અહમદ બાગવાલા અને અશરફ કોઠારી ઘસી આવ્યા હતા. આરીફ અને અશરફ સોહેલને ધમકી આપતા કહ્યું હતું કે સજ્જુ ક્રી મેટર મે સમાધાન કે લીયે આયે હે, તુ કેસ પાછો ખેંચી લે, સજ્જુ જેલમાં ગયો છે જેનો કોર્ટમાં 2.50 લાખ ખર્ચ થયો છે જે તારે આપવો પડશે, નહીં તો ઘરમાંથી બહાર નીકળવું ભારે પડી જશે.

પ્રેમલગ્ન કરનાર દંપતીએ દીક્ષા લઈ નવા નામ સાથે સંયમ તરફ પ્રયાણ કર્યું

સુરત

અમદાવાદના રહેવાસી પ્રિયાંકભાઈ અને ભવ્યતાબેને વેસુ વિસ્તારમાં રામવિહાર ખાતે દીક્ષા લઈ લીધી છે. નવા નામ અનુક્રમે પરમાર્થી વિજયજી મ.સા. અને ધર્માર્થી રત્નાશ્રીજી મ. સા. મેળવીને દંપતી બાળકોની જેમ સંયમના માર્ગે નીકળી ચૂક્યું છે. જૈન શાસનને અર્પણ કરીને મુમુક્ષુ પ્રિયાંકભાઈ અને ભવ્યતાબેન પણ સંયમના માર્ગે વળ્યા છે. પૂ.આ.ભ રત્નચન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ડહેલીવાળા)ની પ્રેરણા અને સાથે સાથે પૂ.આ. ભ. ઉદવરત્ન સૂરીશ્વરજી મહારાજની વાચના તેમજ ભાઈ મહારાજ પૂ.મુનિ રાજદર્શન વિજયજી મહારાજ સાહેબના ઘડતરથી આ દંપતી દીક્ષા લેવા માટે તૈયાર થયા હતા. દંપતી દીક્ષા સાથે કુલ મળીને તેમના જ પરિવારમાં 47 દીક્ષા થઈ છે.

તાપી નદીમાં પ્રદૂષણ મુદ્દે PAL થતાં ગાંધીનગર IITનો રિપોર્ટ મંગાવ્યો

સુરત

સુરતની તાપી નદીમાં પ્રદૂષણ અને એક્ઝુઅન્ટ ડિસ્ચાર્જના મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટે ગાંધીનગર આઈઆઈટીને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરી આ અંગે જરૂરી રિપોર્ટ માંગ્યો છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં ફેલાવાતા જોખમી પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં રજૂઆત કરાઈ હતી કે, તાપી નદીમાં આર્સેનલર મીતલ નિપોન સ્ટીલ લિ. દ્વારા ભારે મેટલ, કેમીકલયુક્ત જોખમી એક્ઝુઅન્ટ ટ્રીટમેન્ટ કર્યા વિના બારોબાર છોડી દેવાય છે. જેના કારણે તાપી નદીમાં



ગંભીર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. નદીમાં માછલીઓ અને અન્ય જીવ સૃષ્ટિ માટે પણ પ્રદૂષણ બહુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. આ અંગે વારંવારની રજૂઆત છતાં સુરત મનપા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતના સત્તાધીશો કોઈ કાર્યવાહી કરતાં નથી.

ચીખલીમાં નજીવી ઝઘડા બાબતે મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

નવસારી

રાનવેરીકલ્લા ગામે રહેતા હિતેશ અને કલ્પેશ પટેલ તથા તેમના જ ફળિયામાં રહેતો કૌટુંબિક ભાઈ વિશાલ પટેલ તેમજ અન્ય યુવાનો બે દિવસ અગાઉ નજીવના કુકેરી ગામે લાકડા ભરવા મજૂરીએ ગયા હતા. દરમિયાન લાકડા સાચવીને આપવાની વાત કરતા હિતેશ સાથે વિશાલ પટેલે ઝઘડો કર્યો હતો. જે બાદ મજૂરીથી પરત ફરેલા હિતેશ સાથે વિશાલે બોલાચાલી કરી હિતેશને બે તમાચા ચોરી દીધા હતા. જેથી હિતેશની પત્ની પતિને બચાવવા વચ્ચે પડતા આકોષિત વિશાલે તેને પણ માર માર્યો હતો. હિતેશનો નાનો ભાઈ કલ્પેશ ઘરે આવતા, વિશાલે તેની સાથે પણ મારામારી કરી હતી. તેને ડામરના રસ્તા પર પછાડતા જ કલ્પેશના માથામાં ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)

Last minute student admission

Please contact us on
416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
- DETENTION REVIEWS /
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS

CANADA 94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855

VADODARA 101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817

AHMEDABAD 139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

Job Offer & LMIA

Entrepreneur

Investor Business

Self Employed

Farm Investor

Email.: info@siis.ca Website.: www.siis.ca

30 હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાવર પાર્કની યોજના પડતી મૂકાઈ

કચ્છ

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં ૩૦,૦૦૦ મેગાવોટનો સોલાર અને વિન્ડ પાવરનો પાર્ક બનાવવાનું પડતું મૂકવાની ફરજ પડી છે. આ પગલું લેવાતા ગુજરાતમાં આવનારું રૂપિયા ૧.૫ લાખ કરોડનું મૂડીરોકાણ આવતું અટકી જશે. કચ્છ જિલ્લા પાકિસ્તાનની સરહદથી ઘણો નજીક હોવાથી આ પ્રોજેક્ટ પડતો મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાવડાનો આ વિસ્તાર બોર્ડર સિક્યોરિટી ફોર્સ માટેનો વિસ્તાર છે. સરહદી સલામતીના આ વિસ્તારમાં સોલાર પાર્ક બનાવવો ઉચિત ન હોવાનું જણાતા નિર્ણય બદલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦માં આ સોલાર વિન્ડ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારે રણની ઉજ્જડ જમીન પર સોલાર-વિન્ડ પાવર પાર્ક બનાવવાનું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં કરવામાં આવ્યું હતું.



કોલસાથી અને લિગ્નાઈટથી પેદા કરવામાં આવતી વીજળીને કારણે થતાં પ્રદૂષણને ઓછું કરવા માટે અને પર્યાવરણને બચાવવા માટે આ વિસ્તારમાં મેગા પાવર પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના રણમાં સૂર્યનો સારો પ્રકાશ મળવા ઉપરાંત પવનની ગતિ પણ સારી રહેવાની રાણા હતી. તેનાથી ગુજરાતના વીજ વપરાશકારોને ફાયદો મળવાની શક્યતા હતી. પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકારના અધકચરા આયોજનને પરિણામે પ્રોજેક્ટને પડતો મૂકાયો છે. પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ વપરાશકારોને સસ્તી વીજળી મળવાનો રસ્તો પણ બંધ થયો છે.

રાજકોટમાં રાજકારણીની હેરાનગતિ અંગે પોસ્ટ મુકનારા ASI સસ્પેન્ડ

રાજકોટ

રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુકમાં કરેલી એક પોસ્ટના કારણે છેલ્લા એકાદ સપ્તાહથી ભારે વિવાદ જાગ્યો હતો. ત્યારે તપાસ બાદ આખરે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ફેસબુક પોસ્ટમાં એક રાજકીય આગેવાન ૪ વર્ષથી હેરાન કરે તેવો આક્ષેપ કર્યો હતો. પોસ્ટ પરથી જણાઈ આવે છે કે, હિતેન્દ્રસિંહે તે રાજકીય આગેવાનના બનેલીના ત્યાં જુગાર અંગે દરોડો પાડ્યો હતો અને ત્યારથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા. જોકે આ સમગ્ર મામલે વિવાદ જાગ્યા બાદ તેમણે મિત્રને મેસેજ કરવાના બદલે તે ફેસબુક પોસ્ટ થઈ ગઈ હોવાનો બચાવ કર્યો હતો. આ સાથે જ તેમણે તે પોસ્ટ પણ દૂર કરી દીધી હતી. પોસ્ટમાં કથિત રાજકીય આગેવાન પાણી પણ ન મળે તેવી જગ્યાએ બદલી કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પોરબંદરના દરિયામાં ડૂબી રહેલા જહાજમાંથી 22 લોકોને બચાવાયા

પોરબંદર

બુધવારે પોરબંદર નજીક દરિયામાં ડૂબી રહેલા એક વેપારી જહાજના 22 કૂ મેમ્બર્સને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવ્યા હતા. બચાવકાર્ય માટે પ્રતિકૂળ હવામાન હોવા છતાં ICGની ઝડપી કાર્યવાહીથી 22 કૂ સભ્યોના જીવ બચી ગયા હતા, જેમાં એક પાકિસ્તાની અને એક શ્રીલંકન નાગરિકનો પણ સમાવેશ થાય છે.

બુધવારે સવારના 8.20 વાગ્યાની આસપાસ ICG ને સંદેશો મળ્યો હતો કે દરિયા વચ્ચે વેપારી જહાજ ગ્લોબલ કિંગ-1માં પાણી ભરાઈ જતા ડૂબવાની શક્યતા છે. પાણી ભરાયેલ જહાજ 6 હજાર ટન બીટ્યુમીન વહન કરીને જઈ રહ્યું હતું. આ જહાજ પોરબંદરના દરિયાકાંઠે 185 કિમી દૂર હતું. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં ડૂબી રહેલા જહાજની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આસપાસના



જહાજોને માહિતી રિલે કરવા માટે ICG એર સ્ટેશન પોરબંદરથી ડોનિયર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું.

ત્યાર બાદ બે એએલએચ ઘુવ યોપર્સની મદદથી બચાવ કામગીરી શરુ કરવામા આવી હતી. કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામા આવેલ કુ મેમ્બરોમા 20-ભારતીય, 1-પાકિસ્તાન અને 1-શ્રીલંકાના કુ મેમ્બરોનો સમાવેશ થાય છે. ICGનું ઓફિશર પેટ્રોલ વેસલ જે પહેલાથી જ દરિયામાં હતું, તેને પણ તરત જ આ ડૂબતા જહાજ પાસે પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં સાળી સાથે આંખ મળી જતા પતિએ પત્નીનો કાંટો કાઢ્યો

ચોટીલાના ઢોકળવામાંથી 44 દિવસે વીછિયાની પરિણીતાનું કંકાલ મળ્યું

રાજકોટ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ જોગરાજીયાની પુત્રી રંજના લગ્ન રાજેશ ઓળકીયા સાથે 4 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ અવાર નવાર સાસરે જતા રાજેશને સાળી ઈન્દુ સાથે આંખ મળી ગઈ હતી. આ વાતની જાણ તેણે પતિથી છુપાવી હતી, પરંતુ પતિને આ વાતની જાણ થઈ ગઈ હતી. રાજેશ એકવાર ઈન્દુને ભગાડીને પણ લઈ ગયો હતો. પરંતુ બંનેના અનૈતિક સંબંધો રાજેશના સાસરી પક્ષવાળાને મંજુર ન હતા. આથી પરિવારજનોએ ઈન્દુને ફેરબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની અન્ય સ્થળે સગાઈ પણ નક્કી કરાઈ હતી. રાજેશ સાળી સાથેના પ્રેમમાં

બાધા બનતી પત્ની રંજનનું કાસળ કાઢવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પત્નીને તારીખ 22 મેના રોજ ઢોકળવાની વીડમાં લઈ જઈ ચાર્જરના કેબલ વડે ગળે ફાંસો દઈ હત્યા કરી હતી. તેના બાદ લાશને પથ્થર નીચે સંતાડી દીધી હતી. ત્યારે મહિલાના મોત મામલે કોળી સમાજના આગેવાનો અને મૃતકના પિયરવાળા લોકો આજે સિવિલ હોસ્પિટલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મૃતકના પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે, આરોપી રાજેશને ફાંસીની સજા થાય અને જે પોલીસ કર્મચારીઓએ અરજી લીધા પછી પણ તપાસ ન કરી તેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. આ ઘટનામાં ચોટીલાના ઢોકળા ખાતેથી પરિણીતાનું કંકાલ હત્યાના 44 દિવસ પછી મળી આવ્યું હતું.

કંડલાથી મુંબઈ જતી સ્પાઈસજેટ ફ્લાઈટનું ઈમરજન્સી ઉતરાણ, બે અકસ્માત ટળ્યા

મુંબઈ

બુધવારે સ્પાઈસજેટના એક વિમાનમાં ટેકનિકલ ખામી બાદ તેનું લેડિંગ કરવું પડ્યું હતું. જાણકારી અનુસાર કંડલાથી મુંબઈ તરફ ઉડાન ભરનાર સ્પાઈસજેટના વિમાન નંબર SG 3324 પર કૂઝના દરમિયાન P2 સાઈડ વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું એરક્રાફ્ટની બાહરની બારી સામાન્યથી વધુ દબાણના



કારણે ચોંપી ગઈ હતી. જોકે પાયલોટોએ તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી દીધું છે. 19 દિવસમાં સ્પાઈસજેટના વિમાનોમાં આ પ્રકારની સાતમી ઘટના છે. આ પહેલાં બુધવારે સવારે દિલ્હીથી દુબઈ જનાર સ્પાઈસજેટની SG-11 ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી બાદ પાકિસ્તાનના કરાંચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જોકે વિમાનમાં મુસાફરો સુરક્ષિત રહ્યા છે.

First Flight
FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

1 LB \$20 વધુ દર LB ના \$6
 11 LB \$55 વધુ દર LB ના \$6
 23 KG \$185, વધુ દર KG ના \$10
 30 KG \$230, વધુ દર KG ના \$10

ખાવા-પીવાની વસ્તુ
 USA મોકલવા માટે
 FDA ની એપ્રુવલ
 અમે કરી આપીશું
 (Extra Charge)

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની
 હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)

519, Ray lawson
 boulevard , Unit-3,
 Brampton ON L6Y 0N2
 Chandni Chowk Plaza,
 ATN Wireless Board Door
 Open Last Unit Ours
 Phone
 647-761-1317,
 647-657-9631
 -----: MON-FRI : -----
 11.00 AM to 7.00 PM
 : SAT-SUN :
 1.00 PM to 6.00 PM

Scarborough

WE ARE RE-OPENING
 880 Markham Road,
 Unit-8 Main Intersection
 Markham Road & Painted
 Post, Near Saileela
 Khaman-Dhokla
 House Complex,
 Phone
 647-761-1317
 647-657-9631
 905-673-9631
 -----: MON-THU : -----
 2.00 PM to 7.00 PM
 FRIDAY WEEKLY OFF
 : SAT-SUN :
 11.00 AM to 6.00 PM

Mississauga

WE MOVED TO
 6800 REXWOOD
 ROAD, UNIT - D
 : Phone :
 905-673-9631
 647-761-1317
 647-657-9631
 -----: SAT-SUN :-----
 11.00 AM to 5.00 PM
 -----: MON-FRI : -----
 9.30 AM to 5.00 PM
 ----: WEEKENDS :----
 11.00 AM TO 5.00PM

૬૪૭-૭૬૧-૧૩૧૭

www.firstflightcanada.com

સ્વદેશ
CANADA

Registration # 869127209

Publication Mail Agreement /

Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,
 Brampton ON L6S 0B4.
 416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi

Director : Nilesh Tailor

Sub Editor : Chhaya Gandhi

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk,
 Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.



કાજોલ વેબ સીરીઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે

મુંબઈ : અજય દેવગણે વેબ સીરીઝ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. હવે તેની પત્ની કાજોલ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે. જોકે ગયા વરસે તેની એક ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ ચુકી છે, પરંતુ હવે તે વેબ સીરીઝમાં કામ કરીને નવી પાળીની શરૂઆત કરી રહી છે. સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાજોલે ઇ ફેમિલી મેન ટુથી બાણીતી થયેલી સુપર્લ વર્માના એક પ્રોજેક્ટમાં કામ કરવાની સહમતિ આપી દીધી છે. રિપોર્ટનો દાવો છે કે, તેણે આ પ્રોજેક્ટ સાધન કર્યો છે.



સ્પર્દેશ

FRIDAY, 08 JULY, 2022

09

મશિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં બે અલગ-અલગ અવતારમાં દેખાશે ઐશ્વર્યા



મુંબઈ: બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા એકવાર ફરી સિલ્વર સ્ક્રીન પર છવાઈ છે. મશિરત્નમની અપક્રમિંગ ફિલ્મ પોન્નિયન સેલ્વન પાર્ટ-1 નો ઐશ્વર્યા રાયનો લુક રિવીલ કરી દેવાયો છે. લુક પોસ્ટરમાં ઐશ્વર્યાની સુંદરતા કોઈ પણ દેગ કરી શકે છે.


પરુવરની રાણી નંદિનીના પાત્રમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના ટ્રેડિશનલ લુક ફેન્સને દીવાના બનાવી દીધા છે. ઓરેન્જ સિલ્ક સાડી, નેકપીસ, ઝુમકા, માંગટિકા, બિંદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન ગોર્જિયસ ડીવા લાગી રહી છે. આ લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના લોન્ગ હેરને ખુલ્લા રાખ્યા છે. આ સુંદર લુક પર પોતાની કાલિલ નજર ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. ક્વીન નંદિનીની ભૂમિકામાં ઐશ્વર્યા વાસ્તવિક ક્વીન લાગી રહી છે. તેમના લુકથી નજર હટાવવી મુશ્કેલ છે. આ તો બસ એક ઝલક છે ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં તમને ઐશ્વર્યાના એવા કેટલાક સુપર ગોર્જિયસ લુકસના દીદાર થશે, જેને જોઈ તમે તેમની સુંદરતા પર વારી જશો. સોશિયલ મીડિયા યુઝર્સને પણ ઐશ્વર્યાનો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. બોલીવુડ ડીવાના યુઝર્સ વખાણ કરતા થાકી રહ્યા નથી. ફિલ્મ **Ponniyin Selvan** નો પહેલો પાર્ટ થિયેટરમાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આને હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો વિક્રમ, કાર્થીનો લુક પહેલા જ રિવીલ કરાઈ ચૂક્યો છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય બે અલગ અલગ અવતારમાં નજરે પડશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેમાં જયમ રવિ, તૃષા, શરદ કુમાર, વિક્રમ બાબૂ, શોભિતા ધૂલિપાલા, પ્રકાશ રાજ મહત્વના રોલમાં જોવા મળશે. પોન્નિયન સેલ્વન એપિક પીરિયડ ડ્રામા છે.

સામંથા બોલીવૂડમાં આયુષ્યમાનની હિરોઈન તરીકે શરૂઆત કરશે

મુંબઈ : સાઉથની જાણીતી હિરોઈન સામંથા રુથ પ્રભુ બોલીવૂડમાં આયુષ્યમાન પુરાના સામે હિરોઈન તરીકે ડેબ્યુ કરશે તેવા અહેવાલો છે. તેનો મતલબ એ કે સામંથાએ પહેલી ફિલ્મમાં માત્ર ગ્લેમરસ ડોલ તરીકેનો રોલ સામંથાની હિંદી બેલ્ટમાં વધતી લોકપ્રિયતાને વટાવવા એક પછી એક નિર્માતાઓએ તેને સાઈન કરવા માંડી રહ્યા છે. તાજેતરમાં તાપસી પન્નુએ પણ કન્ફર્મ કર્યું હતું કે પ્રોડ્યુસર તરીકેની તેની ફિલ્મમાં સામંથા હિરોઈન હશે. આ ઉપરાંત અક્ષય કુમારની એક ફિલ્મમાં પણ તે હિરોઈન તરીકે આવી રહી હોવાનું ચર્ચા છે. આ જ ફિલ્મના સિલસિલામાં તે કોફી વીથ કરણની નવી સિઝનમાં પણ અક્ષય સાથે દેખાવાની છે. જોકે, આ બધી ચર્ચાઓ વિશે કેટલાક અહેવાલ અનુસાર તેની ડેબ્યુ ફિલ્મ આવતાં વર્ષે આયુષ્યમાન પુરાના સાથે આવશે. દિનેશ વિજયની આ ફિલ્મ હાલ પ્રિ પ્રોડક્શન સ્ટેજ પર છે. આ વર્ષના અંતે તેનું શૂટિંગ ચાલુ થશે અને ૨૦૨૩માં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.



હાથમાં LGBTQના ઝંડા સાથે સિગારેટ પી રહેલા 'કાલી' માતાને જોઈને ભડક્યાં લોકો



દેશમાં વિવિધ ધાર્મિક મુદ્દે તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઈન્ડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર અંગેનો વિવાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. હકીકતે 'કાલી' નામની આ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરમાં હિંદુઓના આરાધ્ય દેવી કાળકા માતા, મા કાલીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં આર્ટિસ્ટ કાલી માની વેશભૂષામાં એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં એલજીબીટીક્યુ (LGBTQ) સમુદાયના પ્રાઈઝ ફ્લેગ સાથે જોવા મળે છે. આ પોસ્ટર જોઈને લોકોમાં ખૂબ જ રોષ વ્યાપ્યો છે.

ફિલ્મમેકર, એક્ટર, પોએટ અને ડાયરેક્ટર લીનાએ ગત તા. 2 જુલાઈના રોજ ટ્વિટર પર પોતાની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર શેર કર્યું હતું. સાથે જ તેણે પોતે ખૂબ જ ઉત્સાહિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે, તેની ડોક્યુમેન્ટ્રી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ (Rhythms of Canada) માં લોન્ચ થઈ હતી. લીનાની આ પોસ્ટના કારણે હિંદુ સમુદાયના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને સોશિયલ મીડિયામાં તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. સાથે જ ટ્વિટર પર 'એરેસ્ટ લીના મણિમેકલઈ' હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ અમિત શાહથી લઈને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ને ટેગ કરીને આ પોસ્ટર અને ફિલ્મ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રના ટ્રેલર અંગે પણ વિવાદ જાગ્યો હતો. તેમાં એક્ટર મંદિરમાં જૂતા પહેરીને દર્શાવાયાનો આરોપ લગાવાયો હતો. ત્યાર બાદ દર્શકોએ મેકર્સને ટ્રોલ કરીને ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રિયા રાજવંશના રોલમાં આખરે જેકવેલિન ફર્નાન્ડિઝ જ ફાઈનલ

મુંબઈ : બોલીવૂડની વિતેલા જમાનાની અભિનેત્રી પ્રિયા રાજવંશની ભૂમિકા માટે આખરે જેકવેલિન ફર્નાન્ડિઝને જ ફાઈનલ કરવામાં આવી છે. આ રોલ માટે કેટરીના કેફ અને કરીના કપૂરની પણ વિચારણા કરવામાં આવી હતી. પ્રિયા રાજવંશની લાઈફમાં ગ્લેમર, સક્સેસ અને સસ્પેન્સ એમ બધાં પાસાંનો સમાવેશ થતો હતો.




વિદેશમાં એક્ટિંગના અભ્યાસ બાદ પ્રિયા રાજવંશને ચેતન આનંદની વોર

ફિલ્મ હકીકતથી બોલીવૂડમાં બ્રેક મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બાદ તેમનો ચેતન આનંદ સાથે એવો અતરંગ સંબંધ બંધાયો કે તેમણે આજીવન ચેતન આનંદ સિવાય કોઈ મેકર્સની ફિલ્મમાં કામ કર્યું જ નહીં. ચેતન આનંદની વિદાય પછી એકલા પડી ગયેલાં પ્રિયા રાજવંશની રહસ્યમય સંજોગોમાં 'હત્યા થઈ હતી.

કુબ્રા સેતની પોતાના પુસ્તકમાં નિખાલસ સ્પષ્ટતા મિત્ર સાથે ઇન્ટિમેટ થતાં ગર્ભવતી થઈ હતી

મુંબઈ : સેકેડ ગેમ્સથી જાણીતી થયેલી કુબ્રા સૈતહાલ નજીકના એક અંકલે તેનું યૌન શોષણ કર્યું હતું. કુબ્રાના પોતાના પુસ્તકોપન બુક: નોટ ક્વાઈટ મિમોરને લઈને ચર્ચામાં છે. આ પુસ્તકમાં કુબ્રાએ પોતાની જિંદગીના ઘણા રહસ્યો છતાં કર્યા છે. કુબ્રાએ એક ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. કુબ્રાએ કહ્યું હતું કે, તે વન નાઈટ સ્ટેન્ડ પછી ગર્ભવતી થઈ ગઈ હતી, અને તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. અભિનેત્રીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, તેને પોતાના આ નિર્ણય બદલ કોઈ પસ્તાવો થયો નથી, આ પહેલા તેણે અન્ય એક ખુલાસો કર્યો હતો કે તેના પરિવારના

પુસ્તકમાં ૨૪ ચેપ્ટર્સ છે જેમાંના છલા ચેપ્ટરમાં તેણે પ્રેગન્ટ હોવાની કબૂલાત કરી છે. એ ચેપ્ટરનું શિર્ષક છે, મેં ઉસ સમય માં બનને કો તૈયાર નહીં થી. આ ચેપ્ટરમાં તેણે ૨૦૧૩ની સાલમાં આંદમાનની સફર વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે, એ વખતે હું ૩૦ વરસની હતી, સ્કૂબા ડ્રાઈવનો આનંદ ઉઠાવ્યા પછી હું એક મિત્ર સાથે ઇન્ટિમેટ થઈ ગઈ હતી. એ વખતે મને કાંઈ ભાન કે વિચાર આવ્યા નહોતા. પરંતુ થોડા સમય પછી મને જાણ થઈ હતી કે, હું ગર્ભવતી છું



બોલિવુડમાં નેપોટિઝમ હંમેશા રહેશે પરંતુ પ્રતિભા અને કામનો ડંકો વાગશે

બોલિવુડમાં અનેક એવા કલાકારો છે જેમણે પોતાના અભિનયના જોરે ચાહકોના હૃદયમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હોય. રાજકુમાર રાવ પણ તેમાંથી એક છે જેમણે બોલિવુડમાં પોતાની પ્રતિભાના જોરે નામના પ્રાપ્ત કરી છે.

રાજકુમાર રાવ હાલમાં પોતાની અપક્રમિંગ સાઈકોથ્રિલર ફિલ્મ 'હિટ: ઇ ફર્સ્ટ કેસ' (Hit The First Case)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે સાન્યા મલ્હોત્રા જોવા મળશે. રાજકુમાર રાવે ફિલ્મની રિલીઝ પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદ વિશે વાત કરી છે. તેમણે પોતાના જયદીપ અહલાવત અને પ્રતિક ગાંધી જેવા મિત્રો અને કલાસમેટ્સ વિશે વાત કરી હતી. રાવના આ મિત્રોને ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી ઓળખ મળી રહી

છે. રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, 'ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ હંમેશા રહેશે પરંતુ હવે અનેક તકો છે. મારા કલાસમેટ્સ હતા એવા મિત્રોને હવે ઓળખ મળી રહી છે. તેના માટે ઓટીટી પ્લેટફોર્મનો આભાર માનવો જોઈએ. જયદીપ અહલાવતે 'પાતાલ લોક'માં અને 'સ્કેમ 1992'માં પ્રતીક ગાંધીએ સારું કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ હશે પરંતુ તમારૂં કામ અને પ્રતિભા બોલશે.'

રાજકુમાર રાવે હિટ ફિલ્મો વિશે જણાવતા કહ્યું હતું કે, 'હિટ ફિલ્મની ફોર્મ્યુલા કોઈને પણ ખબર નથી. તમારે પ્રયત્ન કરતા રહેવાનું છે અને પછી તેને ભાગ્ય ઉપર છોડી દેવાનું છે. મેં ક્યારેય એ વિશે નથી વિચાર્યું કે સાઉથની ફિલ્મો શા માટે સારું પ્રદર્શન કરી રહી છે. કદાચ એટલા માટે કે તે સારી ફિલ્મો છે અને સખત મહેનત દર્શાવે છે.'



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

બલ્ગેરિયાની રૂજાએ વનકોઈન નામની ક્રિપ્ટોકરન્સીના નામે ચલાવેલા ધૂપ્પલમાં હજારો ફસાયા

ક્રિપ્ટો ક્વીન રૂજા : 400 કરોડ ડોલરનો ખેલ

આ બી દુનિયામાં છેલ્લાં એક દાયકામાં ક્રિપ્ટો કરન્સીનો કેજ વધ્યો છે. આવા સમયે મીડિયામાં એક સમચાર ચમક્યા છે. જેમાં 400 કરોડ ડોલર કરતા પણ વધુનું કુલેકુ ફેરવીને ફરાર થઈ ગયેલ રૂજાનું નામ ચર્ચામાં આવ્યું છે. અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન આમ તો કાયદાનું પાલન કરાવનારી અને અપરાધોની તપાસ કરાવનારી મુખ્ય એજન્સી છે. આ એજન્સીએ પૂજા ઈગ્નાતોવાને ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂકીને તેને જેલભેગી કરી શકાય એવી માહિતી આપનારને ૧ લાખ ડોલર એટલે કે લગભગ ૮૦ લાખ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું છે. રૂજા સામે વનકોઈન નામે ક્રિપ્ટોકરન્સી કૌભાંડ ચલાવીને લોકોને ૪૦૦ કરોડ ડોલર એટલે કે, લગભગ ૩૨ હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાનો આરોપ છે.

‘ક્રિપ્ટો ક્વીન’ તરીકે જાણીતી રૂજા ડોન કરતાં પણ ખતરનાક છે. રૂજાને ૩૦ દેશોની પોલીસ ઘણાં સમયથી શોધી રહી છે પરંતુ તેનો પતો લાગતો નથી. ૨૦૧૭માં રૂજાનાં કૌભાંડમાં બહાર આવ્યાં પછી તેની સામે અમેરિકામાં એરેસ્ટ વોરંટ નીકળ્યું હતું. એફબીઆઈ તેના સુધી પહોંચે એ પહેલાં તો રૂજા છૂ થઈ ગઈ હતી. એફબીઆઈ છેલ્લાં પાંચ વર્ષથી રૂજાને શોધે છે પણ તેમાં સફળતા મળી નથી. વળી, એફબીઆઈએ તેની ઝુંબેશમાં આખા યુરોપની પોલીસને પણ કામે લગાડી છે. બીજા જે પણ દેશો સાથે અમેરિકાને સારા સંબંધો છે એ બધાંને રૂજા વિશે માહિતી મોકલી અપાઈ છે. લાખો પ્રયાસો છતાં રૂજાના સગડ નહીં મળતાં

એફબીઆઈએ આખરે તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સમાવવી પડી છે. પોલીસ અને બીજી એજન્સીઓ તો ના શોધી શકી, હવે સામાન્ય લોકો એક લાખ ડોલરના ઈનામની લાલચમાં કંઈક માહિતી આપી દે તો તેને પકડી શકાય તેમ માનીને એફબીઆઈએ છેલ્લું હથિયાર અજમાવ્યું છે. રૂજાનો કિસ્સો લોમ્બિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે તેવો છે. મૂળ બલ્ગેરિયાની રૂજાએ વનકોઈન નામની ક્રિપ્ટોકરન્સીના નામે રીતસરનું ધૂપ્પલ ચલાવ્યું હતું. વનકોઈનની શરૂઆત ૨૦૧૪માં રૂજાએ સેબાસ્ટિયન ગ્રીનવુડ સાથે મળીને કરી હતી. રૂજા અત્યારે ચાલીસેક વર્ષની છે પણ ૨૦૧૪માં એકદમ રૂપકડી યુવતી હતી. તેથી લોકો તેના રૂપથી અંજાઈને તેના ઉપર વિશ્વાસ મુકી દેતા.

રૂજા લોકોને વાતોમાં એ રીતે ફસાવતી કે,



સામેવાળો લલચાય જાય. રૂજા કહેતી કે, તેમનો બિઝનેસ ક્રિપ્ટોકરન્સી છે પણ એ સીધી રીતે ના કરી શકાય તેથી એજ્યુકેશન મટીરિયલના આદાનપ્રદાનના બહાને ક્રિપ્ટો બિઝનેસ કરવો પડે છે. ક્રિપ્ટોકરન્સીની સલામતી માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. રૂજાએ કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના સાદી પોન્ઝી સ્કીમ મૂકીને ક્રિપ્ટોકરન્સી હોવાનો દેખાવ ઉભો કર્યો અને અનેક લોકો વિશ્વાસ કરીને રોકાણ કરવા માંડ્યા.

ક્રિપ્ટોકરન્સી એ વખતે નવોસવો શબ્દ હતો તેથી કોઈને તેના વિશે ખબર નહોતી. રૂજાની ક્રિપ્ટો કરન્સી વનકોઈન બીજા કોઈ પ્લેટફોર્મ પર સોદા જ નહોતા પડતા છતાં કોઈને શંકા જ ના ગઈ. કોઈ પણ પ્રકારના શિક્ષણ માટે માગદર્શન આપતાં પેકેજ રૂજા ૧૦૦ યુરોથી શરૂ કરીને ૧.૧૮ લાખ ડોલરમાં વેચતી. ખરીદદાર નાણાં

વર્ષમાં રૂજાએ ૪૦૦ કરોડ ડોલરનું રોકાણ કરાવ્યું. રૂજાની કંપનીનાં કોમ્પ્યુટરો ઉપર વનકોઈન ક્રિપ્ટોના સોદા થતા અને ભાવમાં વધારો ઘટાડો થતો તેથી લોકો એમ જ માનતાં કે, બધું બરાબર ચાલે છે.

રૂજાએ ૧ માર્ચ, ૨૦૧૬ના દિવસે એલાન કર્યું કે, મેન્ટેનન્સ માટે બે અઠવાડિયાં સુધી બજાર બંધ રહેશે, તેથી કોઈ સોદા નહીં થાય. એ વખતે રૂજાએ વનકોઈનને બ્લોકચેઈન નેટવર્ક સાથે જોડવાનું એલાન કર્યું પરંતુ ૧૫ માર્ચે ફરી સોદા શરૂ થયા ત્યારે કશું બદલાયેલું નહોતું. આ રીતે રૂજાએ બીજાં બે વર્ષ પસાર કર્યા અને છેવટે ૨૦૧૭માં કહેવાતું એક્સચેન્જ બંધ કરીને છૂમંતર થઈ ગઈ. જે બાદ કેટલાક દિવસો સુધી વનકોઈન વિશે કંઈ સાંભળવા ન મળતાં લોકોએ ફરિયાદો કરવાનું શરૂ કર્યું તેથી તપાસ શરૂ થઈ. આ સમયે રૂજા તો કરોડો રૂપિયાનું કુલેકી

ફેરવીને પલાયન થઈ ગઈ હોવાનું બહાર આવ્યું. અમેરિકામાં પણ વનકોઈનના રોકાણકારો હતા તેથી એફબીઆઈ સક્રિય થઈ અને એરેસ્ટ વોરંટ બહાર પાડ્યું. તપાસ કરતાં ખબર પડી કે, રૂજાની ગેંગે તો ૪૫૦ કરોડનો ચૂનો લગાવી દીધો છે. દુનિયાભરમાં દરોડા શરૂ થયા તેમાં ચીનમાંથી લગભગ ૨૭ કરોડ ડોલર મળ્યા, બીજે બધે રૂજાની ગેંગ બધું સાફ કરીને લઈ

ગઈ હતી. રૂજાની સાથે તેનો ભાઈ કોન્સ્ટેન્ટિન પણ આ વેપલામાં સામેલ હોવાથી તે ફરાર થઈ ગયો. એફબીઆઈએ તપાસ ચાલુ રાખી તેમાં ૨૦૧૮માં સૌથી પહેલો ગ્રીનવુડ ઝડપાયો. ગ્રીનવુડની ઉલટતપાસમાં કોન્સ્ટેન્ટિનનો પત્નો લાગ્યો તેથી તેને ૨૦૧૯ના માર્ચમાં ઝડપી લેવાયો.

જે બાદ પોલીસે આ ગોરબધંધામાં સંડોવાયેલા ૯૭ લોકોને ઝડપ્યા પણ રૂજા ના પકડાઈ. ગ્રીનવુડ, કોન્સ્ટેન્ટિન વગેરે સામે ઠગાઈ, મની લોન્ડરિંગ વગેરેની કલમો હેઠળ કેસ ચાલે છે. આ બધાંને ૯૦ વર્ષની જેલની સજા થશે જ એ નક્કી છે. રૂજા ૨૦૧૭ના ઓક્ટોબરમાં બલ્ગેરિયાથી ગ્રીસ જતી ફ્લાઈટમાં બેઠી પછી ગાયબ થઈ ગઈ હતી. ગ્રીસમાં ફ્લાઈટ લેન્ડ થઈ પછીના સીસીટીવીમાં રૂજા દેખાતી નથી, તેથી તેણે એરપોર્ટમાં ઉતરીને લૂક બદલી લીધો હોવાનું મનાય છે. એફબીઆઈનું માનવું છે કે, રૂજાએ પહેલાં જ ગાયબ થઈ જવાની વ્યવસ્થા ગોઠવી રાખી હતી. એ માટેના નક્કી દસ્તાવેજો પણ બનાવી લીધા હશે અને પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરો બદલી દીધો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

રૂજા ગાયબ થઈ ત્યારે તેની પાસે ૫૦ કરોડ ડોલર હતા એ જોતાં એશિયાના કોઈ પણ દેશમાં પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરો બદલીને રહેવું તેના માટે સરળ છે. રૂજાએ ખરેખર પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય તો એ પકડાય એવી શક્યતા નથી. રૂજા ક્યાં છે એ ખબર નથી પણ દુનિયાભરની એજન્સીઓને તેણે જે રીતે થાપ આપી છે તેના પરથી સ્પષ્ટ છે કે, એકદમ કિમિનલ માર્ફન્ટ્સ છે. ‘ક્રિપ્ટો ક્વીન’ રૂજા તો બહુ ગાજેલો કિસ્સો છે પણ આ રીતે ક્રિપ્ટોના નામે દુનિયાભરમાં કેટલાંક ધૂપ્પલ ચાલે છે, લોકોના અબજો રૂપિયા લૂંટાય છે. લોકો ઝડપથી નાણા કમાઈ લેવાની લાલચમાં ક્રિપ્ટો કરન્સીની માયાજાળમાં ફસાય છે અને પછી રાતા પાણીએ રડે છે. એફબીઆઈના ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓના લિસ્ટમાં ભદ્રેશ કુમાર છગનભાઈ પટેલ નામનો ગુજરાતી યુવાન પણ છે. ભદ્રેશ પટેલને ૨૦૧૭માં ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સમાવાયા હતો. મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કંટોરડી ગામના ભદ્રેશ પટેલના માથે પણ એક લાખ ડોલરનું ઈનામ જાહેર કરાયું છે.

ઉત્તર અમેરિકા અને યુરોપીયન નેટવર્કને લક્ષ્યાંકિત કરતું અત્યાધુનિક માલવેર જોવા મળ્યું છે. જે રિમોટ એક્સેસ ટ્રોજન તરીકે કામ કરે છે. ZuoRAT માલવેર સ્મોલ ઓફીસ / હોમ ઓફીસ (SOHO) પ્રકારના રાઉટર્સને ટાર્ગેટ કરે છે.

લુમેન બ્લેક લોટસ લેબ્સના સંશોધકોએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ZuoRAT માલવેર પોતાના ટ્રોજનને સ્થાનિક નેટવર્કમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવાની અને LAN સાથે કનેક્ટેડ સીસ્ટમ પર એક્સેસ મેળવવા માટે નેટવર્ક કમ્યુનિકેશનને હાઈજેક કરીને એક સીક્યોર કનેક્શન બનાવવાની ક્ષમતા આપે છે.

ZuoRAT માલવેર ફેલાવવાની પ્રક્રિયા COVID-19 ના પ્રારંભિક મહિનાઓ દરમિયાન 2020 ની શરૂઆતમાં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. જે ASUS, Cisco, DrayTek અને NETGEAR ના રાઉટર્સને લક્ષ્યાંકિત કરી સ્ટીલ્થ કામગીરી કરે છે અને 2 વર્ષ સુધી રડારમાં રહી શકે છે જો રાઉટર્સને રીસેટ કરવામાં ન આવે.

ગ્રાહકો અને રીમોટ યુઝર્સ નિયમિતપણે SOHO રાઉટરનો ઉપયોગ કરે છે. પરંતુ આ ડિવાઈસનું ભાગ્યે જ નિરીક્ષણ કરવામાં આવે છે અથવા પેચ કરવામાં આવે છે. જેના કારણે આ ડિવાઈસમાં બગ હોય છે. આ નબળાઈનો ફાયદો હેકર્સને મળે છે.

રિમોટ એક્સેસ ટૂલ લોડ કરવા માટે જાણીતી અનપેચ પામીઓ માટે સ્કેન કરીને રાઉટર્સની પ્રારંભિક એક્સેસ મેળવવામાં આવે છે. તેનો

ZuoRAT માલવેર



ઉપયોગ કરીને નેટવર્કની એક્સેસ મેળવે છે અને આગલા તબક્કાના શેલકોડ લોડરને છોડે છે. જેનો ઉપયોગ કોબાલ્ટ સ્ટ્રાઈક અને કસ્ટમ બેકડોર જેમ કે CBeacon અને GoBeaconને પહોંચાડવા માટે થાય છે.

ZuoRAT એ SOHO રાઉટર્સ માટે સંકલિત MIPS ફાઈલ છે જે હોસ્ટ અને આંતરિક LAN ની ગણતરી કરી શકે છે. રાઉટર્સ પર પેકેટ્સ કેપ્ચર પણ કરી શકે છે જેથી મેન-ઈન-ધ-મિડલ (MITM) એટેક, DNS અને HTTPS હાઈજેકિંગ પણ શક્ય છે. પોર્ટ 21 અને 8443 પર TCP કનેક્શન હાર્વેસ્ટ કરવા માટેનું ફંક્શન પણ સામેલ છે. જે FTP અને વેબ બ્રાઉઝિંગ સાથે સંકળાયેલા છે. જેનું મુખ્ય ધ્યેય યુઝર્સની એક્ટીવીટી પર નજર રાખવાનું છે.

ZuoRAT માલવેરની અન્ય ક્ષમતાઓ એટેકર્સને રીકવેસ્ટ હાઈજેક કરવાના ઉદ્દેશ્ય સાથે

DNS અને HTTPS ટ્રાફિકને મોનિટર કરવાની મંજૂરી આપે છે. ત્યારબાદ મેલીસીયસ ડોમેઈનનો ઉપયોગ કરી સિસ્ટમની ટેમ્પરરી ડીરેક્ટરીમાં મેલીસીયસ કોડ ડાઉનલોડ કરે છે. હેકર્સ દ્વારા તેની પ્રવૃત્તિઓ છુપાવવા માટે આ એકમાત્ર પગલું નથી. કારણ કે એટેક્સ એક અસ્પષ્ટ, બહુ-તબક્કાના C2 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે. જેમાં પ્રારંભિક RAT શોષણને છોડવા માટે વર્ચ્યુઅલ પ્રાઈવેટ સર્વરનો ઉપયોગ કરવો અને પ્રોક્સી C2 સર્વર તરીકે એટેક થયેલા રાઉટરનો લાભ લેવાનો સમાવેશ થાય છે.

વધુ તપાસ ટાળવા માટે સ્ટેર્જીંગ સર્વર પર ટેપીટી રીતે વેબસાઈટ હોસ્ટ કરવામાં આવી છે. એક ઉદાહરણમાં “muhsinlar.net” નામની વેબસાઈટની નકલ કરે છે. જે તુર્કસ્તાન ઈસ્લામિક પાર્ટી (TIP) ચીનમાંથી ઉદ્ભવતા ઉર્ધુગુર ઉગ્રવાદી સંગઠન માટે પ્રચાર પોર્ટલ છે.

હાઈજેકિંગ કાર્યક્ષમતા અનપેચ રાઉટરથી નેટવર્કમાં અન્ય વર્કસ્ટેશનો પર પ્રવેશ કરવા માટે પરવાનગી આપે છે. જેથી કસ્ટમ-બિલ્ટ ટ્રોજન લોચ કરવા માટે જવાબદાર લોડર પેલોડનો ઉપયોગ કરવામાં આવે. આ એટેક્સ પાછળના વિરોધી સામૂહિકની ઓળખ અજ્ઞાત છે. જો કે કલાકૃતિઓના વિશ્લેષણમાં ચીનના ઝિયાનચેંગ પ્રાંત અને અલીબાબાના યુક અને ટેન્સેન્ટા કમાંડ-એન્ડ-કંટ્રોલ (C2) માટેના સંભવિત સંદર્ભો જાહેર થયા છે.

beinghumanmj

કવચિત્રિ સંઘમિત્રા રાયગુરુ (રાંચી, ઝારખંડ)

અનુવાદક: હિના મોદી

શીર્ષક : ઇશક

હવે નહીં પૂછો મને

કે ઇશક શું છે ?

ઇશક શું છે ?

ઇશકમાં હું છું,

ઇશકમાં તું છે;

ઇશકમાં આખું બ્રહ્માંડ છે.

હા, કોઈ જાતનાં નામ

પર કુહવાચ ગયા,

કોઈ ધર્મનાં નામ પર

વેરાન થઈ ગયા;

કોઈ રાજદારી નજરોમાં

બેઘર થઈ ગયા.

છતાં પણ,

ઇશક તો માટીની સુગંધ છે,

ઇશક તો જળનો પ્રવાહ છે;

ઇશક તો હવાનાં ઘુંઘરું છે.

હવે નહીં પૂછો મને-

કે, ઇશક શું છે ?

ઇશક શું છે ?

લોહીનો રંગ છે ઇશક,

શુન્ય થી અનંત સુધીની

મુસાફરી છે ઇશક .

અપનાવી જુઓ આ ઘરેલું ટીપ્સ

- ફણસની સીઝન હોય ત્યારે ફણસના બિયાંને ફેંકી ન દેતા તેને છોલી તડકામાં સુકવી તેનો ભૂક્કો કરી શીશીમાં ભરી રાખવો. કરી બનાવતી વખતે તેમાં એક ટેબલસ્પૂન નાખવાથી કરીની સોડમ તથા સ્વાદ વધી જશે.
- સ્કૂને કાટ લાગી ગયો હોય અને સ્કૂ નીકળતું ન હોય તો સ્કૂ પર વિનેગારના થોડા ટીપાં નાખી થોડીવાર રહેવા દેવું. જેથી સ્કૂ થોડો ઠીલો પડી જશે. સ્કૂ ડ્રાઇવરથી સ્કૂ ફેરવતાં તરત જ સ્કૂ બહાર નીકળી આવશે.
- તુલસી, ફૂદીનો, મરી અને આદુનો ઉકાળો

- પીવાથી વાયુની તકલીફથી છૂટકારો મળે છે.
- તેલ,લીંબુનો રસ અને મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંતની તકલીફો જેવી કે દુખાવો,પીળાશ અને દાંતમાંથી લોહી વહેતું બંધ થાય છે.
- ફળને લાંબો સમય તાજા રાખવા એક વાસણમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખવા અને ટાંકણ ટાંકવું નહીં.
- ઈંડાને બાફ્યા હોય તે પાણી ઠંડુ પડે પછી પ્લાન્ટમાં નાખતા પ્લાન્ટને પોષણ મળે છે.

- જૂની પ્લાસ્ટિકની મેટરને ફેંકી ન દેતાં રેફ્રિજરેટરમાં સ્લેવેજ પર રાખવી અથવા કિચનકેબિનેટમાં અખબારના કાગળના સ્થાને મૂકવાના ઉપયોગમાં લેવી.
- સિંધવ ભેળવેલા પાણીથી લાદી કે કિચન પ્લેટફોર્મ વૂછવાથી માખી આવતી નથી.
- તેલમાં પાણી ભળી ગયું હોય તો તેલવાળા વાસણને ફ્રિજરમાં મૂકી દેવું. થોડા કલાકો બાદ બહાર કાઢશે કે પાણી ઉપર તેલ તરતું દેખાશે આ રીતે તેલ પાણી છૂટા પાડી શકાશે.

- સેન્ડવિચ પર દૂધવાળું બ્રશ ફેરવી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને રાખવાથી સેન્ડવિચ તાજી રહે છે.
- કાચના વાસણ ઘોંટી વખતે સિન્કમાં જાડું કપડું પાથરી દેવાથી વાસણ તૂટવાનો ડર નહીં રહે.
- સાબુદાણાની ખીચડીમાં કેસ્ટિકમ મરચાંનો વધાર કરવાથી ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
- પપૈયાની છાલને તડકામાં સૂકવી, બારીક પીસી લેપ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.

**MOTEL
for
SALE**

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: https://niraj-pancholi.c21.ca/

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings



MOTEL KING: Specializing in Selling Motels: LIST & SELL with confidence

Major Achievements: Among TOP 75 PRODUCERS IN CANADA AWARD & CENTURION PRODUCER AWARDS 2017-2021

NEW: 31 ROOM MOTEL IN SAULT STE. MARIE

With 3 BR house, main street of downtown, minutes away from all amenities such as shopping malls, schools, college, hospital, airport etc. & Close to USA border.

Asking Price: \$1.7M

(about 40% to 45% down payment required)

MOTEL OPERATOR / WORKING PARTNER REQUIRED

Good Salary + Partnership (20% to 50%)
Minimum \$200,000 investment required

URGENT LISTINGS REQUIRED MOTELS & HOTELS

Small Motels to Franchise Hotels anywhere in Ontario
Qualified Buyers are ready to close in 1 to 2 months

12 TO 45 ROOM MOTEL IN NORTHERN ONTARIO

Asking Price: \$900,000 To \$5,000,000
(40% to 50% down payment require)

RECENTLY SOLD MOTELS NEAR.....

Blind River, Welland, London, Sarnia, North Bay,
Cochrane, Pembroke, Ottawa, Thunder Bay

JOB AVAILABLE: For the Motel located in Northern Ontario

- **Housekeeper** for room cleaning and general work in the motel, accommodation available for the couple / small family
- **Working Partner** Willing to invest min \$200K, stay & operate/manage the motel offering Partnership + Salary to operate

નેતાઓના રાજીનામા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને હાઈકમાન્ડે ખખડાવ્યા

અમદાવાદ

કોંગ્રેસ નેતૃત્વએ પોતાની ગુજરાત પ્રદેશ શાખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલા કરવાથી અંતર જાળવવાનું કહ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે તેઓ લોકોના મુદ્દાને ઉઠાવે અને આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની નીતિઓ પર નિશાન સાધે. બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માની ઝાટકણી કાઢવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોંગ્રેસની ટાસ્ક ફોર્સ સોમવારે લગભગ 5 કલાક સુધી બેઠક કરી જેમાં

ગુજરાતના નેતાઓને બોલાવવામાં આવ્યા અને તેમને વિધાનસભા ચૂંટણી માટે એકજૂથ થઈને તૈયારી કરવા જણાવ્યું. હાલ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો છે. જે અંગે બેઠકમાં હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.

રઘુ શર્માએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે, ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. જેમાં સૌથી મોટો ફટકો દિગ્ગજ નેતાઓનું પાર્ટી છોડવું છે. ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ તથા આપમાં ગયા છે. જેમાં જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજયગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કેલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. જેથી હાઈકમાન્ડે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે.

આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છે : કેજરીવાલ

નરોડા ખાતે આપના હોદ્દેદારોનો શપથ સમારોહ યોજાયો

અમદાવાદ

આમ આદમી પાર્ટી પણ આ વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જોઈ રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન આપના કાર્યકરોને કહ્યું કે આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેનત કરવાની છે.

આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો આજે અમદાવાદના નરોડા ખાતે શપથ

ગ્રહણ સમારોહ યોજાયો હતો. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ હોદ્દેદારોને ઈમાનદારી અને દેશભક્તિના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની હાજરીમાં તમામ હોદ્દેદારોએ શપથ લીધા હતા.

કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીનું સંગઠન કોંગ્રેસથી વધુ મજબૂત બની ગયું છે. કોંગ્રેસ માત્ર કાગળ પર છે. આજે વિધાનસભા સ્તરનું સંગઠન છે. એક સપ્તાહ બાદ દરેક બુથ પર 10-10 કાર્યકરોનું સંગઠન બનશે. ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અહીંની જનતા ભાજપની નારાજ છે.

જસદણના રાજમાતા પ્રેમીલારાજેની અંતિમવિધિ

જસદણ

જસદણના રાજમાતા પ્રેમીલારાજે શિવરાજકુમાર ખાયર (ઉ. વ. ૮૯)નું સોમવારે અચાનક જસદણ દરબારગઢ ખાતે હાઈ એટેકથી અવસાન થતાં મંગળવારે જસદણ દરબારગઢ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા જસદણ દરબારગઢ ખાતેથી નીકળીને ટેલીફોન એક્સચેન્જ નજીકના રાજવી પરિવારના ખાસ સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી. જ્યાં જસદણ દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાયરના હસ્તે અંતિમ વિધિ કરવામાં આવી હતી. રાજમાતા પ્રેમિલાબાના દીકરી ગાયત્રીબા યોગલે ગોવાથી જસદણ રાજમહેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અંતિમયાત્રામાં અશોકભાઈ ધાધલ, અશોકભાઈ મહેતા, રૂડાભાઈ ભગત સહિતના લોકો હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: જામકંડોરણાથી ગોંડલ જતા મુખ્ય માર્ગ ઉપરનો પુલ ધરાશાયી થયો

ગીર સોમનાથના ગામ બેટમાં ફેરવાયા: વેરાવળ, ઉના, દીવ અને કોડીનારના બસરૂટ બંધ

રાજકોટ

જેતપુરમાં ભારે વરસાદને કારણે જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પુલ ધરાશાયી થયો છે. ધોધમાર વરસાદ પડતા લેધિકા અને ગોંડલનું પાણી ફોફળ નદીમાં આવ્યું છે. જેને કારણે પુલ ધરાશાયી થયો છે. પુલ બેસી જવાથી જામકંડોરણાથી ગોંડલ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આ પુલ સિવાય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી હાલ જામકંડોરણાથી ગોંડલ અન્ય બહારના માર્ગ પરસંદ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

બીજી તરફ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને કારણે જેતપુરના ઉમરાળી

અને મેવાસા ગામમાં પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથમાં બુધવારે વરસાદે તોફાની બેટિંગ કર્યા બાદ આજે પણ સવારથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ બંધાયા બાદ ભારે વરસાદ શરુ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે આ તાલુકાઓના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સોમનાથ-કોડીનાર હાઈવે બંધ થઈ ગયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલને પગલે ST વિભાગ દ્વારા વેરાવળ, ઉના, દીવ અને કોડીનારની ST બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત રુટ પર સેવા બંધ થઈ છે.

ખેડા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું રાજીનામું ખેડા

કોંગ્રેસના ગઢ સમાન ખેડામાં કોંગ્રેસનો આંતરીક ઉકળતો ચરુ આજે ખુલ્લીને બાહર આવ્યો છે. જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને મોટા પાયે ફટકો પડ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સંબોધી પોતાનું રાજીનામું આપ્યું છે. વધુમાં પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે પણ રાજીનામું ધરી દીધું છે. ખેડા જિલ્લા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સમાચાર વહેતા થતાં ખેડા કોંગ્રેસમાં હડકંપ સર્જાયો છે.


Sri Radha Krishna Temple

1960 Ellesmere Road Unit 9 Scarborough ON M1H 2V9
srkt2000@gmail.com 416-431-3311 www.sriradhakrishnatemple.ca

અભિનંદન !

તમામ ગુજરાતી પરિવારોના માત્ર અને માત્ર અંગેજી ભાષા સમજનાર સંતાનો અને સ્નેહીજનો માટે શ્રી રાધા-કૃષ્ણ મંદિર તરફથી વાસ્તવિક જીવનને પ્રતિબિંબિત કરતા અને જીવનને પ્રગતિના રસ્તે લઈ જતા ક્રાંતિકારી પુસ્તકનું અદ્યતન પ્રકાશન હવે ઉપલબ્ધ છે. આ પુસ્તકની નકલ મેળવવા અને પુસ્તકને સ્પોન્સર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવવા આજે જ સંપર્ક કરો :

શ્રી શર્માજી (ફોન નં. : ૪૧૬-૪૩૧-૩૩૧૧)



Parents: Our Treasure
Sri Radha Krishna Temple
(The Canadian Hindu Mission Centre Scarborough)
(Registered Charity # 86219 011RR0001)
1960 Ellesmere Rd Unit 9 Scarborough Ontario M1H 2V9
Tel: 416-431-3311 Email: srkt2000@gmail.com

FOREWORD


“Parents : Our Treasure” is a wonderful and very valuable collection of great firsthand experience and priceless thoughts and comments of Parents and Grandparents themselves in an interesting sequence. Particularly for the children and grand children of the immigrant children of the immigrant families living abroad, this book is an eye opening as well as soul searching and thought provoking masterpiece written by Sh. Niranjana Shah. The best part of this book is that you can open the book on any page and read as much you want to read at a time.

Parents and Grandparents are our Precious and Priceless Treasure, Cherish and treasure your time with your parents. Treasure your parents and grandparents in time, lest it is too late. Parents and Grandparents are inspiration. They sow the seeds of greatness. They are the most special and loveliest people on the earth, or in the three worlds for that matter. They guide, they inspire, they encourage, they love you even if you are wrong. Don't imagine life without their Ashirvad (blessings). Parents and Grandparents are a family's greatest assets and should be honoured, valued and celebrated for everything they have done and for what they are.

Specially for the immigrant families Parents and Grandparents are a strong and stable foundation for keeping family together. They are trunks of the family tree and heritage. They have a wealth experience, skills and wisdom of life. You have to overcome the challenge of the long-distance relationship in foreign countries and in the home country. Even if the grandparents live here or in India, visit them often and ignore the cultural gap and language barrier.


Foster a healthy positive relationship between grandparents and grandchildren. Create opportunities as possible for grandparents to spend their quality time with their grandchildren. Encourage grandchildren to know and love their grandparents, before it is too late.

Prof. Ratnakar Narale Parent and Grandparent, Toronto, Canada.



ઘઘ-ઉલ-અઘઘ મુબારક


અલ્લાહ આપને ઘઘ-ઉલ-અઘઘના મુકદ્દસ અવસર પર તમામ પુશીઓ આપે અને આપની ફુર્કાની કબુલ કરે



Salma Zahid

MP for Scarborough Centre
5-2155 Lawrence Avenue East
Scarborough, ON M1R 5G9
Tel. (416) 752-2358
Fax (416) 752-4624

salma.zahid@parl.gc.ca
salmazahid.libparl.ca



SalmaZahid15 @SalmaZahid15

કોરોનામાં લોકપ્રિય બનેલી દવા ડોલો-650ના ઉત્પાદકને ત્યાં ITના દરોડા

કંપનીએ કરચોરી કરી હોવાની આશંકાએ આવકવેરા વિભાગની કાર્યવાહી કરી

બેંગલુરુ

આવકવેરા વિભાગ દ્વારા બુથવારે બેંગલુરુ સ્થિત ફાર્માસ્યુટિકલકંપની માઈકોલેબ્સ લિમિટેડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કંપની કોરોના કાળ દરમિયાન કોરોનાનાદર્દીઓ માટે ડોલો-650નું ઉત્પાદન કરીને પ્રકાશમાં આવી હતી. કંપની પર કરચોરીનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ કંપનીના દસ્તાવેજો, બેલેન્સ શીટ્સ અને બિઝનેસ ડિસ્ટ્રિબ્યુટર નેટવર્કને તપાસ અભિયાનના ભાગરુપે તપાસી રહ્યું છે. પીટીઆઈએ કંપનીને પ્રશ્નાવલિ મોકલી છે. કંપનીની અન્ય શહેરોમાં આવેલી ઓફિસો, તેના પ્રમોટરો અને વિતરકોના નિવાસ્થાને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કંપનીએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે તે ફાર્માસ્યુટિકલ



પ્રોડક્ટ્સ અને એપીઆઈ બનાવવા સાથે જોડાયેલી છે. તેના સમગ્ર દેશમાં ૧૭ ઉત્પાદન એકમ છે અને તે વિદેશમાં પણ કારોબાર ધરાવે છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ચોંકાવનારી ઘટના તલાક ઈચ્છતી પત્નીને જાહેરમાં પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી

ભોપાલ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક પતિએ ધોળા દિવસે જાહેરમાં પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આરોપી પતિની ઓળખ ર્દસ ખાન તરીકે થઈ છે. આરોપી પત્નીથી એટલા માટે નારાજ હતો કારણ કે, તે તલાક ઈચ્છતી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા પોતાના પતિના શંકાસ્પદ સ્વભાવ અને રોજ કરવામાં આવતી મારપીટથી થાકી ચૂકી હતી. ઘટનાના સીસીટીવી

ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, એક ૨૨ વર્ષની મહિલાને આગ ચાંપી દેવામાં આવી હતી. તેના માથા અને શરીરના ઉપરના ભાગમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. તે મદદ માટે ચીસો પાડતી આમ-તેમ ભાગી રહી છે. રાહદારીઓએ આગ બુઝાવવા માટે ખાડાઓમાં સંગ્રહિત પાણી તેમના પર ફેંક્યું હતું. કેટલાક લોકો પોતાના ઘરમાંથી પાણીની ડોલ લઈને દોડયા અને તેમને બચાવી હતી. બીજી તરફ ર્દસ ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં ધરપકડથી બચી ગયો હતો.

ચીની કંપની વિવો પર આઈટીની રેડ: બે ડાયરેક્ટર્સ ભારત છોડી નાસી ગયા

નવી દિલ્હી

ભારતમાં મસમોટો કારોબાર ચલાવતી ચાઈનીઝ મોબાઈલ કંપની વીવો(વીવો) પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દરોડાની કાર્યવાહી હજી પણ ચાલુ છે. મંગળવાર અને બુધવારે ઈડીએ ૨૨ રાજ્યોમાં ૪૪ સ્થળો પર દરોડા પાડયા હતા. જોકે આ દરોડાની કાર્યવાહી દરમિયાન મળતા અહેવાલ પ્રમાણે હવે વિવોના બે ચાઈનીઝ ડાયરેક્ટરો ભારત છોડીને નાસી છુટ્યાં છે.

મીડિયા અહેવાલ અનુસાર વીવોના

બોર્ડ ઓફ મેમ્બર્સમાં ડાયરેક્ટર પદે ફરજ બજાવી રહેલ ઝેંગશેનોઉ અને ઝાંગ જી પર ઈડીનો ગાળિયો કસાય તે પૂર્વે જ દેશ છોડીને ભાગી ગયા છે. મની લોન્ડરિંગ સંદર્ભે કંપનીની વધતી જતી મુશ્કેલીઓને જોઈને બંને ડાયરેક્ટરો તપાસના ડરથી ભાગી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીને ચાઈનીઝ કંપનીના રોયલ્ટીના નામે હજારો કરોડની મની લોન્ડરિંગની શંકા છે. અન્ય એક તપાસ એજન્સી સીબીઆઈ પહેલાથી જ આ કેસની તપાસ કરી રહી છે. ભારતમાં આઈટી

વિભાગની સાથે સાથે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (એમસીએ) પણ ચાઈનીઝ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીનની મોબાઈલ નિર્માતા કંપની વીવો (વીવો) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડા પછી ચીનની પ્રતિક્રિયા આવી છે. ચીની દૂતાવાસે બુધવારે ૬ જુલાઈએ એક નિવેદન બહાર પાડ્યું હતું. ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શાઓજિયાને કહ્યું કે એવી અપેક્ષા છે કે વીવો ઈન્ડિયા સામેની તપાસ કાયદાકીય માળખામાં હશે.

જમ્મુ - કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ લાંચ કેસમાં CBIના દેશમાં ૧૬ સ્થળે દરોડા

૩. 2200 કરોડના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ માટે લાંચની ઓફર થઈ હતી

નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરના કિશતવાડમાં એક પાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાંચના કેસમાં સીબીઆઈએ ગુરુવારે સમગ્ર દેશમાં ૧૬ સ્થળોએ દરોડા પાડયા હતાં. આ કેસ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ઉજાગર કર્યો હતો. કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ લિમિટેડના 2200 કરોડ રૂપિયાનું સિવિલ કોન્ટ્રાક્ટ આપવામાં કથિત રીતે લાંચ લેવામાં આવી હતી. ૨૦૧૯માં આ લાંચ આપવામાં આવી

હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ આ કેસમાં શ્રીનગરમાં બે, જમ્મુમાં પાંચ, દિલ્હીમાં પાંચ, મુંબઈમાં ત્રણ અને પટણામાં એક સ્થળે દરોડા પાડયા હતાં. આ ૧૬ સ્થળો વચેટિયાઓ અને પ્રોજેક્ટ સાથે સંબંધિત વ્યક્તિઓના છે. તત્કાલીન રાજ્યપાલ મલિકે આરોપ મૂક્યો હતો કે આ પ્રોજેક્ટની મંજૂરી માટે ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું

કે સીબીઆઈ અધિકારીઓને તપાસમાં આરોપી સરકારી અધિકારીઓ દ્વારા કેટલીક શંકાસ્પદ લેવડદેવડની જાણ થઈ હતી. જેમાં ચિનાબ વેલી પાવર પ્રોજેક્ટ લિમિટેડના તત્કાલીન ચેરમેન નવીનકુમાર ચૌધરીની લેવડ-દેવડ પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી મુંબઈમાં પટેલ એજિનિયરિંગના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રૂપેન પટેલ, વિજય ગુપ્તા અને અમરેન્દ્રકુમાર સિંહના પરિસરોમાં તપાસ કરી હતી.

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરૂ સૂફી બાબાની માથે ગોળી મારી હત્યા

મુંબઈ

મહારાષ્ટ્રના નાસિકમાંથી મુસ્લિમ ધર્મગુરૂની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા હુમલાખોરોએ તેમને માથામાં ગોળી મારી હતી. આ ઘટનાને ચાર આરોપીઓએ અંજામ આપ્યો છે. પોલીસ તેમને શોધી રહી છે. નાસિક જિલ્લાના યેવલા શહેરની મળતી માહિતી પ્રમાણે મૃતકનું નામ ખ્વાજા સૈયદ ચિશતી હતું અને સ્થાનિક લોકો તેમને સૂફી બાબા

તરીકે બોલાવતા હતા. ૩૫ વર્ષના સૂફી બાબા અફઘાનિસ્તાનના રહેવાસી હતા. આરોપીઓએ ચિશતી બાબાને યેવલા શહેરના MIDC વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશતી તરીકે થઈ છે, જે યેવલામાં 'સૂફી બાબા' તરીકે ઓળખાતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોએ તેમને માથામાં ગોળી મારી હતી, જેના પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.



500 અને 1000 રૂપિયાની 62 લાખની જૂની નોટો સાથે નવી દિલ્હીથી 1ની ધરપકડ

નવી દિલ્હી

દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારના રમેશ પાર્ક ખાતેથી દિલ્હી પોલીસે ડો. એઝાલ અહમદ નામના વ્યક્તિની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની કરન્સી સાથે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ પાસે ૬૨ લાખ રૂપિયાની જૂની કરન્સી મળી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિએ ૬૨ લાખ રૂપિયાની જૂની કરન્સીને ૧૪ લાખ રૂપિયાની નવી કરન્સીથી ખરીદી છે. પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિએ જણાવ્યું કે, તેમણે આ જૂની નોટ અનેક સ્થળોએથી એકત્રિત કરી છે અને તે લગભગ ૨૦ લાખ રૂપિયામાં આ નોટોને વેચી દે છે. દિલ્હીના શકરપુરા પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે.

દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી 6 સિનિયર અધિકારીઓની ધરપકડ કરાઈ

નવી દિલ્હી

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એ પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા પ્રોજેક્ટને સંડોવતા લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરતા કુલ ૬ સિનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝા અને ટાટા પ્રોજેક્ટના ૫ અધિકારીઓની ધરપકડ કરી છે. આ કેસ ભારત સરકારની માલિકીની વિજ કંપની પાવર

ગ્રીડના લાંચ સંબંધિત છે. આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સીબીઆઈના સુત્રોએ જણાવ્યું છે.

સીબીઆઈના સુત્રોના જણાવ્યા અનુસાર ટાટા પ્રોજેક્ટના ૫ સિનિયર અધિકારીઓ જેમાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન દેશરાજ પાઠક અને આસિસ્ટન્ટ વાઈસ ચેરમેન આર.એન. સિંહ સામેલ છે. સીબીઆઈએ આ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરનું રાજીનામું

શ્રીનગર

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સહિત અનેક પાર્ટીઓ સક્રીય થઈ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ ધમાસણ સર્જાયું છે. હવે આ ધમાસણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીરે ૭ વર્ષથી જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ હતા. વર્ષ ૨૦૧૫માં તેમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મીરે રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. ગુલામ અહમદ મીરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં જણાવ્યું કે, શિસ્તબદ્ધ સૈનિક તરીકે તેમને ઉત્તરાધિકારી માટે પાર્ટી અધ્યક્ષ દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય સ્વીકાર્ય હશે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર તેમજ ભૂસ્ખલનથી દસનાં મોત

વીજળી પડવાથી ઉત્તર પ્રદેશમાં 5 અને રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રણનાં મોત

શિમલા

હિમાચલ પ્રદેશના કુલુ અને શિમલામાં ભારે વરસાદને આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10 લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. શિમલા જિલ્લામાં ઝાકરી ખાતે ફિરોઝપુર શિપકી લા નેશનલ હાઈવે-૫ સહિતના કેટલાક માર્ગો હજુ પણ બ્લોક છે. અનેક વિસ્તારોમાં વીજ અને પાણી પુરવઠાને પણ અસર થઈ છે.

ઉત્તર પ્રદેશના હમિરપુર અને જલોન જિલ્લામાં વીજળી પડતા પાંચ લોકોનાં મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. રથ તેહસીલમાં ત્રણ અને જલોનમાં બે લોકોનાં મોત થયા છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં વીજળી પડવાથી ત્રણ



લોકોનાં મોત થયા છે. બુંદી જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ વીજળી પડી હતી. રાજસ્થાનના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે વરસાદ જામી રહ્યો છે.

કર્ણાટકમાં ચંદ્રશેખર 'ગુરુજી'ની હત્યા, 2 હત્યારાઓની ધરપકડ

હુબલી

કર્ણાટકના હુબલીની એક હોટેલમાં 'સરળ વાસ્તુ'ના નામથી પ્રખ્યાત ચંદ્રશેખર અંગડી ઉર્ફે ચંદ્રશેખર ગુરુજીની મંગળવારે ચાકુ મારીને હત્યા કરી દેવાઈ હતી. હુબલીની પ્રેસિડેન્ટ હોટેલના સીસીટીવી ફૂટેજમાં બે લોકો હોટેલના રિસેપ્શન વિસ્તારમાં ચંદ્રશેખર ગુરુજીને વારંવાર ચાકુ મારતા જોવા મળ્યા હતા. ચંદ્રશેખર ગુરુજીની હત્યાના કલાકોમાં પોલીસે બેલગાવી જિલ્લામાં રામદુર્ગમાંથી બંને હત્યારા મંજુનાથ મારવાડ અને મહંતેશ સિરુરની ધરપકડ કરી હતી. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે બાગલકોટના નિવાસી ગુરુજીએ કોન્ટ્રાક્ટર તરીકે

કારકિર્દી શરૂ કરી હતી અને પછી નોકરી મળતા તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા. અહીં તેમણે વાસ્તુનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્રણ દિવસ પહેલાં પરિવારના એક બાળકનું હુબલીમાં મોત થતા તેઓ શોકસભામાં હાજરી આપવા ગયા હતા.

હુબલીના પોલીસ કમિશનર લભુરામે કહ્યું કે બંને હત્યારાઓની અટકાયત થઈ ગઈ છે અને તેમને હુબલી લાવવામાં આવ્યા છે. ચંદ્રશેખર ગુરુજીની હત્યા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગુરુજીના હત્યારાઓને આકરી સજા અપાવાની ખાતરી આપી હતી.

ચેતવણી છતાં કાચા રસ્તેથી બસ હંકારવામાં આવી

હિમાચલમાં કુલ્લુની ખાઈમાં બસ ખાબકતા 13નાં મોત, બે ઘાયલ

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરી, સીએમએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી



શિમલા

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સેંજમાં સોમવારે સવારે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો, જેને પગલે બસમાં સવાર પૈકી ૧૩ લોકોના મોત નિપજ્યા હતા. બસમાં કુલ ૧૫ લોકો સવાર હતા જોકે બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમની સારવાર ચાલી રહી છે. બસ જંગલા ગામમાં ૨૫૦ મીટર ઉંચી ખાઈમાં પડી ગઈ હતી. જેને પગલે ૧૩ લોકો માર્યા ગયા હતા.

એવા અહેવાલો છે કે હિમાચલ પ્રદેશના જે રોડ પર આ બસ જઈ રહી હતી તે અત્યંત કાચો હતો, જેને પગલે મુસાફરોએ પણ આ રોડ પર બસ ન ચલાવવા ડ્રાઈવર અને બસ

સંચાલકોને ચેતવ્યા હતા. જોકે તેમની આ વિનંતી પર ધ્યાન ન આપવામાં આવ્યું અને ડ્રાઈવરે તે જ રસ્તે બસ ચલાવી જેને પગલે એક ખાઈમાં બસ ખાબકી હતી.

હવે આ સમગ્ર મામલાની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરાવવામાં આવશે. આ ઘટના સવારે ઘટી હતી, બસ ધડાકાભેર ખાઈમાં પડી હતી, જેનો અવાજ ગામના આસપાસના લોકોએ પણ સાંભળ્યો હતો. અવાજ સાંભળતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ૧૩ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમની સારવાર ચાલી રહી છે.

રાહુલ ગાંધીના ફેક ન્યૂઝ ફેલાવનાર એન્કર રોહિત રંજનની ધરપકડ કરાઈ

નવી દિલ્હી



ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજનની મંગળવારે નોએડા પોલીસે ધરપકડ કરી છે. છત્તીસગઢની પોલીસે યુપી પોલીસને જણાવ્યા વગર ન્યૂઝ એન્કરનો ધરપકડ કરી હતી. એન્કર પર રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ હતો, જેનો વીડિયો ન્યૂઝમાં ચલાવાયો હતો જે બદલ ન્યૂઝ ચેનલે માફી પણ માંગી હતી. એન્કરની મંગળવારે સવારે છત્તીસગઢ પોલીસે વોરંટ સાથે ધરપકડ કરવા પહોંચી હતી ત્યારબાદ છત્તીસગઢ-યુપી પોલીસ વચ્ચે મતભેદ થયો હતો જે બાદ અંતે નોયડા પોલીસે એન્કરની ધરપકડ કરી હતી.

મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસ સ્થાને મળ્યા

થાણેના 67માંથી 66 કોર્પોરેટર શિંદેની ટીમમાં સામેલ થઈ ગયા

થાણે

મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક શોકિંગ ઘટના બની છે. થાણે નગર નિગમ પણ હવે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકી ગયું છે. થાણેમાં શિવસેનાના ૬૭ પૈકીના ૬૬ કોર્પોરેટર્સ હવે એકનાથ શિંદેની ટીમમાં સામેલ થઈ ગયા છે. શિવસેના માટે આ ઘટના મોટા શોક સમાન છે. જાણવા મળ્યા મુજબ ટીમ શિંદેમાં જોડાનારા તમામ ૬૬ શિવસેના કોર્પોરેટર્સ મુખ્યમંત્રી એકનાથ

શિંદેને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. મુંબઈ નગર નિગમ બાદ થાણે નગર નિગમ મહારાષ્ટ્રનું સૌથી મહત્વનું અને મોટું નિગમ છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં મજબૂત પકડ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. ૧૯૮૭ના વર્ષમાં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યાર બાદ ૨૦૦૧ના વર્ષમાં નગર નિગમ સદનમાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. ૨૦૦૨ના વર્ષમાં તેઓ બીજી વખત થાણેના કોર્પોરેટર બન્યા હતા.

લાલુપ્રસાદની સારવારનો ખર્ચ બિહાર સરકાર ભોગવશે: મુખ્યમંત્રી નીતિશ કુમાર

પટના

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવને વધુ સઘન સારવાર માટે દિલ્હીમાં એઈમ્સ ખાતે લઈ જવાશે. તેમની સારવારનો ખર્ચ બિહાર સરકાર ભોગવશે તેવી જાહેરાત વર્તમાન સીએમ નીતિશકુમારે કરી હતી. લાલુપ્રસાદને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાયા છે. આ પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે પારસ હોસ્પિટલ પહોંચી લાલુના આરોગ્યની જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે લાલુપ્રસાદ ઝડપથી સ્વસ્થ થઈ જાય. લાલુપ્રસાદની સારવારનો બધો ખર્ચ બિહાર સરકાર ઉઠાવશે.

પ્રાતિજના ઘડકણના ગાંધી અને સાબરકાંઠાના સરદાર તરીકે ઓળખાતા એવા ભૂરાભાઈ પટેલ

સાબરકાંઠાની એક આગવી મહેક છે. એની માટીની એક આગવી સુગંધ છે. અરવલ્લીની પર્વતમાળાઓ જાણે કે એનો મુગટ છે. માઝુમ, મેશ્વો અને વાત્રક એની કટીમેખલા છે. શામળાજીનું મંદિર એની શોભા છે. ઈડરિયો ગઢ એનું ગૌરવ છે. અહીંથી ઉમાશંકર જોશી અને પત્રાલાલ પટેલ, રમણલાલ સોની જેવા સાહિત્યકારો પણ પેદા થયા તો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી જેવા અભિનય સમ્રાટ પણ પેદા થયા. અધ્યાત્મગુરુ જેસીંગ બાવજી પણ અહીં જ પેદા થયા. મુંબઈના લોકોને ઘેલું લગાડનાર નાટ્ય અભિનેતા ચીમન મારવાડી પણ આ જ ભૂમિની પેદાશ છે. સરદાર સાહેબના પુત્રી મણિબહેન પટેલ પણ સાબરકાંઠામાંથી જ ચૂંટણી લડી લોકસભામાં ગયાં. પૂર્વ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાએ પણ સાબરકાંઠામાંથી જ ચૂંટણી લડવાનું પસંદ કર્યું.

શ્રેષ્ઠ નેતાઓ આપ્યા

આવી સાબરકાંઠાની ધરતીએ ખેડૂત સમાજમાંથી જે શ્રેષ્ઠ નેતાઓ આપ્યા, તેમાં તલોદવાલા ચુનીકાકા (ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ), અંબુકાકા, શાંતુભાઈ પટેલ, મગનભાઈ પટેલ, ગોપાળદાસ વેણીભાઈ પટેલ,

કુમુદચંદ્ર રાવળ, બેચરસિંહ રમલાવત, લાલસિંહ રહેવર જેવા અનેકનો સમાવેશ થાય છે. એ જ પેઢીના એક પ્રખર ખેડૂત નેતા હતા ભૂરાભાઈ ખોડીદાસ પટેલ. તેઓ પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામના વતની. સુખી ખેડૂત, લોકો તેમને ભૂરાકાકાના નામથી પણ ઓળખે.

વર્ષો પહેલાં તેમણે સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો માટેની અમૂલ જેવી ડેરી ઊભી કરવાનું સ્વપ્ન નિહાળેલું. એ વખતે બાબુભાઈ રબારી નામના એક યુવાનને લઈ ડેરી ઊભી કરવા કર્યા કરે. બાબુભાઈ રબારીના હાથમાં એક બ્રીફકેસ હોય. તેમાં ડેરી ઊભી કરવાનાં કાગળિયાં હોય, બાબુભાઈ હસમુખા અને હોશિયાર વહીવટકર્તા. એ વખતે દૂધનો ધંધો જે ખાનગી સંસ્થાવસે પાસે હતો. તેઓ પશુપાલકો અને ગ્રાહકોને લૂંટતાં. આ શોષણમાંથી મુક્તિ અપાવવા ભૂરાભાઈ પટેલ આણંદ જઈ ડો. વર્ગીસ કુરિયનને મળ્યા. તેમની સલાહથી ભૂરાભાઈ પટેલે સાબરકાંઠાની આગવી સહકારી ડેરી ઊભી કરવા નિર્ણય કર્યો અને તેમના પ્રયાસોથી ઊભી થઈ 'સાબર ડેરી' જે હિંમતનગરનું એક આગવું નજરાણું છે.



માત્ર છ જ ચોપડી ભણેલા

ભૂરાભાઈ ખોડીદાસ પટેલ કે સાબર ડેરીના સ્થાપક અને ડેરીના પ્રથમ ચેરમેન બન્યા. ઘડકણ ગામના વતની ભૂરાભાઈ ખોડીદાસ પટેલ અને મધ્યમ ખેડૂત પરિવારમાં જન્મેલા માત્ર ગુજરાતી ધોરણ છટું પાસ હોવા છતાં તેમનામાં વિચક્ષણ બુદ્ધિમત્તા હતી. ખેડૂત કુટુંબમાં જન્મેલા હોવાના નાતે ખેતીનો વિકાસ અને ખેડૂતોનું

સાથે ભાષણ કરવાની એમન શૈલી વિશિષ્ટ હતી. પોતાના ૪૨-૮૪ કડવા પાટીદાર સમાજ તેમજ ગુજરાતના અન્ય પાટીદાર સમાજોમાં ચાલી રહેલા જુનવાણી રોવા-કૂટવાના, બારમા-તેરમાના, લગ્ન અને વરઘોડા તેમજ કરિયાવરના ખોટા ખર્ચા, વહેમો-અંધશ્રદ્ધાઓ વગેરે દૂર કરવા અંગે તેમણે જેહાદ ઉપાડેલી. તેથી માત્ર તેમના સમાજના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના સમાજસુધારક તરીકે ગણના પામ્યા હતા.

સહકારી સંઘ સ્થાપ્યો

આજથી પાંચ દાયકા અગાઉના સમયમાં 'દૂધ વેચી ના શકાય' તેવી માન્યતા દૂધ ઉત્પાદકોમાં પ્રવર્તી રહી હતી. જે લોકો દૂધ વેચીને આર્થિક રીતે આવકનું સાધન ઊભું કરવા માગતા હતા તેમનું ખાનગી વેપારીઓ દ્વારા રીતસર શોષણ કરવામાં આવતું હતું. તેવા સમયે પ્રાંતિજ તાલુકાના ઘડકણના વતની ભૂરાભાઈ ખોડીદાસ પટેલ, તલોદના અંબુભાઈ દેસાઈ, પોગલુના ગોપાળભાઈ પટેલે તેમના તાલુકાના દૂધ ઉત્પાદકોને સંગઠિત બનવા અનુરોધ કર્યો હતો. ગ્રામકક્ષાએ દૂધમંડળીની રચના કરવા માટેના સક્રિય

પ્રયાસો શરૂ કર્યા અને તમામ મુશ્કેલીઓ વચ્ચે ૨૭-૧૧-૪૨-૮૪ કડવા પાટીદાર ૧૯૬૪માં પ્રાંતિજ તાલુકાની ૧૯ દૂધ મંડળીઓના સહકારથી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ(સાબર ડેરી) ની સ્થાપના કરવામાં આવી. ૨૯-૧૦-૧૯૬૫(લાભ પાંચમ)ના શુભ દિવસે ઘરે ઘરે ફરીને ૫,૧૦૦ લિટર દૂધ એકત્રિત કરીને જિલ્લામાં કોઈ પ્લાન્ટ કે શીતકેન્દ્ર ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ ડેરીમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ડેરીના પ્રથમ ચેરમેન

જેથી ૧૯૭૦માં તત્કાલીન સાંસદ સી. સી. દેસાઈના પ્રયાસોથી એન.ડી. ડી.બી. તેમજ ઈન્ડિયન ડેરી કોર્પોરેશનના અને દેશના શ્વેતકાંતિના સર્જક ડો. વર્ગીસ કુરિયનના પ્રયાસોથી ઓપરેશન ફલડ નં. ૧ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં અદ્યતન ડેરી પ્રોજેક્ટ ઊભો કરવા રૂ. ૨.૫૨ કરોડની નાણાકીય સહાય મળતાં હિંમતનગર તાલુકાના બોરિયા

(ક્રમશઃ આવતા અંકે)

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102

પ. પૂ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

આપણા વર્તનમાં જ આપણું ભવિષ્ય છુપાયેલું છે

એકવાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરી કે હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે. બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઉંચા કરીને કહ્યું, બધા પોતાના હાથ ઉંચા કરો. આથી ત્યાં હાજર બધાએ પોતાના હાથ ઉંચા કર્યાં. પછી માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે, બધા પોતાના હાથ માથા પર મૂકો. બધાએ તેમ કર્યું. આમ તે વ્યક્તિ જેમ-જેમ બોલતા ગયા, લોકો તેમ-તેમ કરતાં ગયા. ધીમે ધીમે તે વ્યક્તિએ બોલવાનું બંધ કરી કેવળ એક્શન જ કરવાની ચાલુ રાખી. તેમ છતાં લોકો તેની એક્શનને અનુસરતા જ રહ્યા. ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે, મેં તો કેવળ એટલું જ કહ્યું હતું કે, હું જેમ કહું તેમ બધાએ કરવાનું છે. પણ જેમ કરું તેમ કરવાનું ક્યાં કહ્યું હતું ?

રીડર્સ ડાયજેસ્ટમાં એક સમયે આવેલા આ પ્રસંગના આધારે આપણને વર્તનની અસરનો ખ્યાલ આવે છે. આપણે જે બોલીએ છીએ, તેના કરતાં આપણે જે કરીએ છીએ, તેની અસર વધારે થાય છે. મગધ દેશના રાજા બિંબિસારના રાજ્યના પ્રશ્નમાં પણ, આ જ સિદ્ધાંત રામભાણ ઈલાજ સાબિત થયો. પ્રશ્ન એ હતો કે, તેમના રાજ્યના ગરીબ માણસો ઘાસના ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ લાપરવાહ ખૂબ હતા. તેના કારણે એમના જ ઝૂંપડામાં આગ લાગી જતી. આવા ઘણા અગ્નિકાંડ થયા એટલે રાજાએ જાહેર કર્યું કે, જેનું ઘાસ સળગશે, તેણે એક વર્ષ સુધી સ્મશાનમાં રહેવું પડશે. આ સાંભળી લોકો સાવધ થયા. પરંતુ હજુ થોડા ઝૂંપડા તો સળગતા જ હતા, અને લોકો સજા પણ ભોગવતા હતા.

એક દિવસ રાજાના ઘાસના ગોડાઉનમાં જ આગ લાગી. રાજા બિંબિસારે જ્યારે આ વાત જાણી, ત્યારે તેઓ પોતે પણ સ્મશાનમાં જવા તૈયાર થયા. બધાએ ખૂબ સમજાવ્યા. આમ છતાં તેઓ ન જ માન્યા અને રાજમહેલ છોડી તેઓ સતત એક વર્ષ સુધી સ્મશાનમાં જઈને રહ્યા. તેમના આ વર્તનનું પરિણામ એ આવ્યું કે, ત્યાર પછી જ્યાં સુધી તેમણે શાસન કર્યું, ત્યાં સુધી એક પણ ઝૂંપડું સળગ્યું નહીં.

અંગ્રેજીમાં એવું કહેવાય છે કે "your actions speak

louder than words.' એટલે કે તમારા શબ્દો કરતાં તમારું વર્તન વધારે વાતો કરે છે. એટલે જ મહાપુરુષો કેવળ બોલતા જ નથી, પણ તે પ્રમાણે વર્તીને લોકોને સમજાવે છે. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે.

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः।

स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।

મહાપુરુષો જે જે આચરણ કરે છે, સામાન્ય મનુષ્યો તેને જ અનુસરે છે.

પ્રમુખસ્વામી મહારાજે જે ઉપદેશ આપ્યો છે. તે કેવળ બોલ્યા જ નથી, પણ એ પ્રમાણે વર્તીને સમજાવ્યું છે.



બોચાસણ ગામમાં એકવાર તેઓ મંદીર પરિસરમાંથી પસાર થતા હતા. ત્યાં વચ્ચે બાથરૂમ આવ્યું. તેમણે સહેજ થોભી અંદર ડોકિયું કર્યું, તો ઘણી દુર્ગંધ આવતી હતી. એટલે કંઈ પણ બોલ્યા વગર તેઓ બાથરૂમમાં અંદર ગયા અને બાથરૂમ અંદરથી બંધ કર્યું.

આ સમયે તેમની સાથેના સંતોને થયું કે તેઓ લઘુશંકા (પેશાબ) કરવા ગયા છે. પરંતુ અંદર તો તેમણે ગાતરિયું ખીટીએ લટકાવ્યું, ધોતિયાનો કણોટો માર્યો અને સાવરણો લઈને બાથરૂમ સાફ કરવા લાગ્યા ! એ ગંદી ટાઈલ્સ જ્યાં સુધી ચોખ્ખી ચણાક ન થઈ, ત્યાં સુધી ઘસ્યા જ કર્યું.

બહાર ઊભેલા સંતો-યુવકોને તો આ વાતની ત્યારે ખબર પડી,

જ્યારે પ્રમુખસ્વામી મહારાજે બાથરૂમ એકદમ ચોખ્ખું કરીને દરવાજો ખોલ્યો. બહાર નીકળી તેઓ તો એક પણ શબ્દ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા. પરંતુ સાથે ઊભેલા સૌને, એક પણ શબ્દ વગર સ્વચ્છતાનો સંદેશ મળી ગયો.

વિશ્વવ્યાપી BAPS સંસ્થાના ઘણી હોવા છતાં, તેમણે વર્તનમાં ઉતારીને સંદેશો આપ્યો છે. તેમના આ વર્તનમાંથી પ્રેરણા લઈને અમેરિકાના ચેરીહિલના સમૃદ્ધ તબીબ ડો.રાજીવ વ્યાસ, કે જેમની નીચે ૮૦૦ માણસો અને ૩૮ ડોક્ટરો કામ કરે છે, આમ છતાં રોજ સવારે તેઓ મંદિર દર્શને આવીને ભક્તિભાવપૂર્વક મંદિરના સંડાસ-બાથરૂમ સાફ કરે છે.

સુરતમાં પણ લાખો રૂપિયાનો વ્યાપાર કરનારા યુવાનોનું એક વૃન્દ દર રવિવારે મંદિરમાં સંડાસ-બાથરૂમ સાફ કરે છે. ?આવા તો કંઈક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રમુખસ્વામી મહારાજને આદર્શ માનીને સ્વચ્છતાની સેવામાં લાગ્યા છે.

એટલે જ અમેરિકાના રાજકીય નેતા હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે સદાચારનો કેવળ બોધ જ નહોતો આપ્યો. પરંતુ તે મૂલ્યો અનુસાર પ્રત્યેક દિવસ જીવ્યા હતા.

આજે ઘણા માતા-પિતાની ફરિયાદ હોય છે કે, તેમના સંતાનો તેમના કહ્યામાં રહેતા નથી. તેનું એક કારણ માતા-પિતાનું વર્તન પણ છે. કારણ કે, માતા-પિતાનું વર્તન એ બાળક માટે દર્પણ છે. જેમ દર્પણમાં આપણે આપણી છબી જોઈએ છીએ, તેમ માતા-પિતાના વર્તનમાં બાળક પોતાની છબી જોવે છે, અને તે પ્રમાણે જ વર્તે છે.

સ્વીડિશ ગવર્નેન્ટ દ્વારા કિશોર અવસ્થાના અપરાધીઓનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં કારણ નીકળ્યું કે, માતા-પિતાના વર્તનમાં જીવનનાં જે મૂલ્યો હોય છે, તે જ મૂલ્યોને તેમના સંતાનો મુખ્યત્વે ગ્રહણ કરતા હોય છે. માટે આપણા વર્તનમાં જ આપણું ભવિષ્ય છુપાયેલું છે. સારું વર્તન કરીશું તો સારી અસર અનુભવાશે, અને ખરાબ વર્તન કરીશું તો ખરાબ અસર અનુભવાશે. કેવું વર્તન કરવું ? તે નિર્ણય આપણા હાથમાં છે.

- સાધુ અચલકીર્તિદાસ

પ્રથમ ટી-20માં ભારત સામે ઈંગ્લેન્ડનો 50 રને પરાજય

51 રનની શાનદાર ઈનિંગ રમનાર હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ જાહેર : ભારતના 8 વિકેટે 198, ઈંગ્લેન્ડ 148 રનમાં સમેટાઈ

સાઉથમ્પટનમાં રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 50 રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રનમાં સમેટાઈ ગઈ હતી.

બેટિંગ પછી, હાર્દિકે બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી અને ચાર ઓવરના ક્વોટામાં 33 રન આપીને ચાર વિકેટ



લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હાર્દિક T20 ઈન્ટરનેશનલમાં 50થી વધુ રન બનાવનાર અને ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. રોહિત સતત 13 T20 જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો છે.

ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ટેસ્ટમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20

શનિવારે બર્મિંગહામમાં રમાશે. બીજી ટી20માં ભારતીય સિનિયર ખેલાડીઓ વાપસી કરશે. આ મેચમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અચ્ચર અને ઋષભ પંત પુનરાગમન કરશે. અર્શદીપે 148 રનમાં ઈંગ્લેન્ડની ઈનિંગ્સને ટીપક ડુડાના હાથે કેચ આઉટ કરીને મેથ્યુ પાર્કિન્સનને સમેટી લીધી હતી. ક્રિસ જોર્ડન 26 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ચાર વિકેટ ઝડપી હતી. તે જ સમયે, અર્શદીપ અને ચહલને બે-બે વિકેટ મળી હતી.

રટ-બેરિસ્ટોની સદી વડે ઈંગ્લેન્ડે ઇતિહાસ રચી શ્રેણી ૨-૨થી ડ્રો કરી

બર્મિંગહામ

અનુભવી બેટ્સમેન જોઈ રુટ અને જોની બેરિસ્ટોની અણનમ સદીની મદદથી ઈંગ્લેન્ડે એજબેસ્ટન ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે ભારતને સાત વિકેટે હરાવીને પાંચ ટેસ્ટની શ્રેણી ૨-૨થી સરભર કરી હતી. ઈંગ્લેન્ડે ચોથા દાવમાં વિક્રમી રનચેઝ કરીને માત્ર ત્રણ વિકેટના ભોગે ૩૭૮ રન બનાવ્યા હતા. અંતિમ દિવસે વિજય મેળવવા માટે ઈંગ્લેન્ડને વધુ ૧૧૯ રનની જરૂર હતી. રુટ અને બેરિસ્ટોએ મુક્તમને ફટકાબાજી કરીને લંચ પહેલાં જ વિજય કરી લીધો હતો.



ઈંગ્લેન્ડના ચોથા દાવમાં જોઈ રુટે ૧૭૩ બોલમાં ૧૯ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૧૪૨ તથા જોની બેરિસ્ટોએ ૧૪૫

બોલમાં ૧૫ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૧૧૪ રન બનાવ્યા હતા. બન્નેએ ચોથી વિકેટ માટે અણનમ ૨૬૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભારતે ૧૫ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી ઉપર ટેસ્ટ શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી હતી. છેલ્લે ૨૦૦૭માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડ સામે ૧-૦થી શ્રેણીવિજય મેળવ્યો હતો. રોહિત શર્મા અને લોકેશ રાહુલની ગેરહાજરીમાં ભારતીય ટીમ ટેસ્ટ ડ્રો કરશે તેવું માનવામાં આવતું હતું પરંતુ ઈંગ્લેન્ડ સામે બીજા દાવમાં ભારત સંપૂર્ણપણે ફ્લોપ રહ્યું હતું.

જાબેર-રિબાકિના વચ્ચે ફાઈનલ રમાશે

લંડન

ત્રીજી ક્રમાંકિત ટયૂનેશિયાની ઓન્સ જાબેરે વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઈનલમાં જર્મનીની તાલ્જાના મારિયાને ૬-૨, ૩-૬, ૬-૧થી હરાવીને પ્રથમ વખત કોઈ મેજર ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જાબેર કોઈ પણ ગ્રાન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ આરબ તથા આફ્રિકન મહિલા ખેલાડી બની ગઈ છે. જાબેર મુકાબલો જીતવા માટે એક કલાક ૪૩ મિનિટનો સમય લીધો હતો. જાબેરનો ફાઈનલમાં રિબાકિના સામે મુકાબલો થશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં શિખર ધવનને અંતે નેતૃત્વ સોંપાયું

નવી દિલ્હી

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં રમાનારી ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે ભારતના ૧૫ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીમાં ડાબોડી ઓપનર શિખર ધવનને સુકાની બનાવવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજા ઉપસુકાની રહેશે. વિન્ડીઝના પ્રવાસે જનારી ટીમમાં સિનિયર ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રિષભ પંત તથા પેસ બોલર જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને તેમને આરામ અપાયો છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવર્સની શ્રેણી બાદ



સીધી વિન્ડીઝ રવાના થશે. શ્રેણીની ત્રણેય મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાશે. આ વન-ડે શ્રેણી બાદ ભારતીય ટીમ પાંચ ટી૨૦ મુકાબલા રમશે અને તેના માટેની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. વિરાટ કોહલી અને સુકાની રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવર્સની શ્રેણીમાં રમશે.

ટેસ્ટ રેન્કિંગમાં કોહલી છ વર્ષ બાદ પ્રથમ વખત ટોપ-૧૦માંથી બહાર થયો

દુબઈ ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગના બેટ્સમેનોની યાદીમાં પાંચ સ્થાનના ફાયદા સાથે સર્વશ્રેષ્ઠ પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે. બીજી તરફ સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી છ વર્ષના પ્રથમ વખત ટોપ-૧૦માંથી બહાર થયો છે. કોવિડ-૧૯ના કારણે સ્થગિત કરવામાં આવેલી અને તાજેતરમાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે બન્ને દાવમાં પંતે ૧૪૬ અને ૫૭ રન બનાવ્યા હતા. પંતે છેલ્લી છ ટેસ્ટ ઈનિંગમાં બે સદી અને ત્રણ અડધી સદી નોંધાવી છે.

ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી ચાર ક્રમાંકની પીછેહઠ કરીને ૧૩મા ક્રમાંકે સરકી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો સામનો કરનાર કોહલી વન-ડે તથા ટી૨૦ રેન્કિંગમાં પણ પીછેહઠ કરી રહ્યો છે. એજબેસ્ટન ટેસ્ટના બીજા દાવમાં અણનમ ૧૪૨ રન નોંધાવનાર ઈંગ્લેન્ડના જોઈ રુટે પોતાનું ટોચનું સ્થાન વધારે મજબૂત કર્યું છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન અને સ્ટિવ સ્મિથ અનુક્રમે બીજા તથા ત્રીજા ક્રમાંકે છે.



ટોરોન્ટોના વર્લ્ડ કપનો ખર્ચ હવે 10 મિલિયન ડોલર વધી જશે: અહેવાલ

ઓન્ટેરિયો

ટોરોન્ટોમાં ચાર વર્ષ બાદ 2026માં વર્લ્ડ કપ યોજાશે, ત્યારે એક અહેવાલ અનુસાર આ ઈવેન્ટનો ખર્ચ પહેલાની સરખામણીમાં 10 મિલિયન ડોલર જેટલો વધુ હશે. ટોરોન્ટોમાં પાંચ રમતોના આયોજનનો અંદાજિત ખર્ચ હવે 2026 સુધીમાં 300 મિલિયન ડોલર થશે.

પ્રાંતીય અને ફેડરલ સરકારો આ રકમના લગભગ બે તૃતીયાંશ ભાગને આવરી લે તેવી અપેક્ષા છે. જો કે, વિગતવાર નાણાકીય જવાબદારીઓ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. અહેવાલ મુજબ, આગામી મંગળવારે મેયર જોન ટોરીનાં નેતૃત્વવાળી

એક્ઝિક્યુટિવ કમિટી આંશિક રીતે વ્યાપારીક પ્રસારણોનાં અધિકારો દ્વારા થનારી આવકના આધારે સરકારો ઉપર કેટલો બોજ આવશે તેનો અંદાજ રજૂ કરવામાં આવશે અને આયોજકોને સરકાર દ્વારા કેટલી મદદ મળશે તે પણ જાહેર થશે. જૂનના મધ્યમાં વર્લ્ડ કપ માટે યજમાન શહેર તરીકે ટોરોન્ટોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી, જેને કારણે શહેરના ફૂટબોલપ્રેમીઓમાં આનંદનો માહોલ છે. ટોરી સરકારને એપ્રિલમાં નોમિનેશન સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી હતી, જો કે, હાલની સ્થિતિ જોતાં બધું ભંડોળ સરકાર પૂરું પાડી શકે એમ નથી.

ઝાંગ યિ માનને ૨૮ મિનિટમાં હરાવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં, પ્રણોયની આગેકૂચ

સાઈ પ્રણીય અને કશ્યપ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા

કુચાલાલપુર

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચીનની ઝાંગ યિ માનને સીધી ગેમમાં હરાવીને મલેશિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિનર સાતમી ક્રમાંકિત સિંધુએ ૩-૦થી ક્રમાંકિત ચાઈનીઝ ખેલાડી ઝાંગને ૨૮ મિનિટમાં ૨૧-૧૨, ૨૧-૧૦ના સ્કોરથી હરાવી હતી. તેનો આગામી મુકાબલો પરંપરાગત હરીફ ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિંગ સામે થશે. ગયા સપ્તાહે મલેશિયા ઓપન ૫૦૦ સિરીઝમાં સિંધુને હરાવનાર યિંગનો ભારતીય ખેલાડી સામેનો રેકોર્ડ પાંચ પરાજય અને ૧૬ વિજયનો છે. મેન્સ સિંગલ્સમાં એચએસ



પ્રણોય ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો. બી સાઈ પ્રણીય અને પી. કશ્યપનો પરાજય થયો હતો. બી સાઈ પ્રણીયને ચીનના લિ શિ ફેંગે ૨૧-૧૪, ૨૧-૧૭ના સ્કોરથી હરાવ્યો હતો. પ્રણોયે ચાઈનીઝ તાઈપેઈના વાંગ જૂ વેઈને ૨૧-૧૯, ૨૧-૧૬ના સ્કોરથી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.

શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘની વેદના આઈએમએફ પાસે લોન લેવી થઈ મુશ્કેલ

કોલંબો

શ્રીલંકામાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભોજનની સાથે-સાથે લોકોને દવાઓ અને પેટ્રોલ અને ડીઝલ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે જણાવ્યું હતું કે, શ્રીલંકા નાદારીમાં છે કારણ કે, દાયકાઓ બાદ દેશ તેની સૌથી ખરાબ નાણાકીય કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે, લાખો લોકોને ખોરાક, દવા અને બળતણ ખરીદવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ, વિક્રમસિંઘે ધારાસભ્યોને જણાવ્યું હતું કે, દેશની પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાટાઘાટો કરવી મુશ્કેલ છે, કારણ કે 22 મિલિયન (22 મિલિયન) દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર વિકાસશીલ દેશને બદલે નાદાર દેશ તરીકે વાટાઘાટો કરવા માટે આગળ વધી રહ્યો છે. શ્રીલંકાના વડાપ્રધાને સંસદમાં કહ્યું, હવે અમે એક નાદાર દેશ તરીકે



વાતચીતમાં ભાગ લઈ રહ્યા છીએ. તેથી અમે પહેલાની વાટાઘાટો કરતાં વધુ મુશ્કેલી અને જટિલ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ. નાદારીની સ્થિતિને કારણે, આપણે આપણા દેશને IMF સમક્ષ અલગ રીતે રજૂ કરવો પડ્યો છે, જે ખૂબ જટિલ છે. શ્રીલંકા સાત દાયકામાં તેના સૌથી ખરાબ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

ચીનના એક અબજ નાગરિકોના ડેટાની ચોરી કર્યાનો હેકરનો દાવો

હૉંગકોંગ

હેકરે શાંઘાઈ પોલીસના એક ડેટાબેઝમાંથી ચીનના એક અબજ નાગરિકોનો ડેટા પ્રાપ્ત કરવાનો દાવો કર્યો છે. જો આ હેકરનો દાવો સાચો સાબિત થશે તો આ અત્યાર સુધીની ડેટા ચોરીની સૌથી મોટી ઘટનાઓમાં પૈકીની એક ગણાશે.

ઓનલાઈન હેકિંગ ફોરમ બ્રીચ ફોરમે ગત સપ્તાહમાં એક પોસ્ટમાં ચાઈનાડેન નામના હેન્ડલનો ઉપયોગ કરીને લગભગ ૨૪ ટેરાબાઈટ ડેટા વૈચવાની ઓફર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ માહિતી ચીનના એક અબજ લોકો સાથે સંકળાયેલી છે અને બે લાખ ડોલરની કીમતના ૧૦

બિટકોઈન સાથે જોડાયેલી છે. ડેટામાં કથિત રીતે શાંઘાઈ રાષ્ટ્રીય પોલીસની માહિતી છે જેમાં લોકોનાં નામ, સરનામું, રાષ્ટ્રીય ઓળખ નંબર અને મોબાઈલ ફોન નંબર તથા કેસની વિગતો સામેલ છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા જોવામાં આવેલા ડેટા અનુસાર આ પ્રકારના એક નમૂનામાં નામ, જન્મતારીખ, ઉંમર અને મોબાઈલ ફોનની વિગતો હતી. ઉદાહરણ સ્વરૂપે એક નામ ૨૦૨૦માં જન્મેલ વ્યક્તિનું છે. તેની ઉંમરની સામે એક લખેલ છે જેના પરથી સાબિત થાય છે કે ડેટામાં બાળકોની પણ માહિતી છે. જો કે અત્યાર સુધી આ ડેટાને સમર્થન આપવામાં આવ્યું નથી.

સિડનીમાં વરસાદથી આવેલા પૂરથી 50 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત

વાઇરસની ઓળખ વીડીપીવી-2 તરીકે કરવામાં આવી

રિયમોન્ડ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પૂરને કારણે અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ૫૦,૦૦૦થી વધુ લોકોને અસર થઈ છે. સ્ટેટ ઈમરજન્સી સર્વિસ મેનેજર એશલે સુલિવનના જણાવ્યા અનુસાર સિડની વિસ્તારમાં ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે પાણીમાં ફસાયેલા ૧૦૦થી વધુ લોકોને બચાવ્યા હતાં. ૫૦ લાખની વસ્તી ધરાવતા સિડની છેલ્લા ૧૬ મહિનામાં ચોથી વખત પૂર આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ડેમોમાં

પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સરકારે સ્થાનિક સરકાર હેઠળ આવતા ૨૩ વિસ્તારોમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. સરકાર પૂર અસરગ્રસ્તો માટે નાણાકીય મદદની પણ જાહેરાત કરી છે. ન્યૂ સાઉથ વેલ્સના પ્રિમિયર રોમિનિક પેરેટોટે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તેમના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 50 હજાર અસરગ્રસ્તો જેમાંથી ૩૨,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


USના ભયે સંતાડેલી મુલ્લા ઓમરની કાર તાલિબાને 21 વર્ષ બાદ ખોદીને બહાર કાઢી

અમેરિકી હુમલાથી બચવા માટે મુલ્લા ઓમર ગાયબ થઈ ગયા બાદ કાર દાટી દેવાઈ

કાબુલ

તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરની કારને 21 વર્ષ પછી તાલિબાની લડાકુએ જમીનમાંથી ખોદીને બહાર કાઢી છે. અમેરિકી હુમલાથી બચવા માટે મુલ્લા ઓમર ગાયબ થઈ ગયા હતા અને તે વખતે કાર જમીનમાં દાટીને ગયા હતા. અમેરિકામાં થયેલા 9/11ના હુમલા પછી અફઘાનિસ્તાનમાં અમેરિકી હુમલા શરૂ થયા હતા. તે વખતે મુલ્લા ઓમર અમેરિકી સૈન્યથી બચવા માટે

છુપાઈ ગયા હતા. હવે તાલિબાની લડાકુએ 21 વર્ષ પછી પોતાના કમાન્ડરની કાર જાબુલ પ્રાંતના એક સ્થાનેથી ખોદીને બહાર કાઢી છે. તેમણે કારની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ કરી છે. મુલ્લા ઓમર તે સમયે કંદહારથી જાબુલ સુધી આ ટોચોટા કારમાં આવ્યા હતા અને પછી કારને જમીનમાં દાટીને ભાગી ગયા હતા. બે દાયકા પછી કારને જમીનમાંથી બહાર કાઢવામાં આવી હોવા છતાં તે સલામત હતી.



પોઈલીવરના સમર્થકોને કારણે હું નેતૃત્વની ઝુંબેશમાંથી આઉટ થયો છું: પેટ્રિક બ્રાઉન

કેટલાક કાર્યકરો પાર્ટીને અલગ માર્ગ ઉપર લઈ જવા માંગતા હોવાનો આક્ષેપ

ટોરોન્ટો

પેટ્રિક બ્રાઉન કહે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીની સ્થાપનાના સભ્યો અને નેતૃત્વના ઉમેદવાર પિયર પોઈલીવરના સમર્થકોએ તેમને નેતૃત્વની સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવાનું કામ કર્યું છે. કારણ કે તેઓને ડર હતો કે, રૂઢિચુસ્તતા પ્રત્યેનો તેમનો પ્રગતિશીલ અભિગમ તેમને જીતી દેશે.

બ્રાઉને બુધવારે મીડિયાના કાર્યક્રમ દરમિયાન હોસ્ટ વેસી કેપેલોસને જણાવ્યું હતું કે, “પાર્ટી એસ્ટાબ્લિશમેન્ટ નર્વસ હતી કે પિયર પોઈલીવર જીતશે નહીં. પિયર પોઈલીવરના સમર્થકો, આ ગેરલાયકાત પાછળ જવાબદાર છે. તેઓ જાણે છે કે અમે વિવિધ સમુદાયોમાંથી 150,000 જેટલા નવા કન્ઝર્વેટિવ્સ

લાવ્યા છીએ. તેઓ પક્ષને તેમના અતિ રૂઢિચુસ્તતાને બદલે એક અલગ માર્ગ ઉપર લઈ જવા માંગતા હતા. બ્રાઉને જણાવ્યું હતું કે પક્ષે અગાઉ ન લીધેલા હોદ્દા લેવાના તેમના નિર્ણયે પક્ષમાં કેટલાકને અસ્વસ્થ બનાવ્યા હતા અને તેમની સામે પ્રતિક્રિયા આપી હતી.” મેં ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું, તમે કોને પ્રેમ કરો છો, તમે ક્યાં જન્મ્યા છો, તમારી ત્વચાનો રંગ, તમે ક્યા ભગવાનની પૂજા કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે દરેક માટે લડવાના છીએ. મેં કહ્યું કે હું પ્રાઈડ પરેડમાં હાજરી આપીશ. હું ઈસ્લામોફોબિયાને પડકારીશ. બ્રાઉનની ઝુંબેશ દ્વારા કહેવામાં આવ્યું કે પાછળથી તે નિર્ણયની અપીલ કરશે અને વરિષ્ઠ કન્ઝર્વેટિવ અધિકારીઓને મોકલેલા પત્રો શેર કરશે.

શિકાગોમાં પરેડ વખતે ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ

હાઈલેન્ડ પાર્ક

અમેરિકાના શિકાગો શહેરમાં હાઈલેન્ડ પાર્ક નજીક સ્વતંત્રતા દિવસ પરેડ દરમિયાન થયેલી ગોળીબારની ઘટનામાં પોલીસે સોમવારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ રોબર્ટ ક્રિમો છે જે 22 વર્ષનો છે. આ શંકાસ્પદ વ્યક્તિને ઈલિનોઈસના હાઈલેન્ડ પાર્ક શહેરમાં એક મોટા પાયે શોધ કર્યા બાદ કસ્ટડીમાં લીધો હતો. લેક કાઉન્ટી શેરિફ કાર્યાલયે તેના વિશે જાણકારી આપી હતી અને કહ્યું કે, ક્રિમો કસ્ટડીમાં હતો. આ પહેલા



પોલીસે ચેતવણી આપી હતી કે, તે સશસ્ત્ર હતો અને તે ખૂબ જ ખતરનાક છે. ઈમરજન્સી ઓફિસર્સે જણાવ્યું કે, ગોળી વાગવાથી ઘાયલ થયેલા લગભગ 24 લોકોમાં અનેક બાળકો પણ સામેલ હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. બંદૂકધારીએ દુકાનની છત પરથી પરેડમાં સામેલ લોકો પર ગોળીબાર કર્યો હતો.

59 દેશોમાં મંકીપોક્સના કુલ 6027 કેસ નોંધાયા, ત્રણ મોત : WHO

જુનીવા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે મંકીપોક્સના સામાહિક મામલમાં 77 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને વિશ્વમાં કેસની સંખ્યા 6000ને પણ આંબી ગઈ છે. આફ્રિકન દેશમાં મંકીપોક્સથી 3 દર્દીઓના મોત થયા હતા. મોટાભાગના કેસ યુરોપ અને આફ્રિકામાં સામે આવ્યા છે. WHOએ જણાવ્યું કે 59 દેશોમાં મંકીપોક્સના 6027 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. 27 જૂનના રોજ પૂરા થનાર સપ્તાહની સરખામણીએ કેસોની સંખ્યામાં 2614 કેસનો વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં મંકીપોક્સથી ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. WHO મંકીપોક્સ મુદ્દે આગામી બેઠક 18મી જુલાઈના રોજ યોજશે.

અમેરિકાએ 15 જૂન સુધી 6,61,500ને નાગરિકતા આપી

અમેરિકાની નાગરિકતા મેળવવામાં ભારતીયો બીજા ક્રમે, મેક્સિકો પહેલું

વોશિંગ્ટન

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોનારા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ સપનું પુરું કરવા અણરિકા જાય છે. યુએસસીઆઈએસના એક રિપોર્ટમાં આ બાબતને સમર્થન મળે છે. આ વર્ષે અમેરિકાની નાગરિકતા લેનારા લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે જ્યારે મેક્સિકો ટોચ પર છે. અમેરિકાએ ૨૦૨૨ દરમિયાન ૧૫મી જૂન સુધીમાં ૬,૬૧,૫૦૦ને

નાગરિકતા આપી છે. અમેરિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૫મી જૂન સુધીમાં ૬,૬૧,૫૦૦ લોકોને નાગરિકતા આપી છે. ૨૦૨૨ના પહેલા ત્રિમાસિકમાં મેક્સિકો પછી ભારત પ્રાકૃતિક અમેરિકન નાગરિકો માટે જન્મના દેશ તરીકે બીજો સૌથી મોટો દેશ છે. સમગ્ર વિશ્વમાં લાખો લોકોને અમેરિકાને તેમનું ઘર બનાવવા આકર્ષક કર્યા છે તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના ડિરેક્ટર એમ. જડોયુએ કહ્યું હતું.

સિંગાપોરમાં ડ્રગ્સ ટ્રાફિકિંગના ગુનામાં ભારતીય મૂળના નાગરિકને મૃત્યુદંડની સજા

સિંગાપોર

સિંગાપોરમાં ભારતીય મૂળના નાગરિકની ફાંસીની સજાનો અમલ થયો હતો. ૨૦૧૬માં કોર્ટે ભારતીય મૂળના કલવંત સિંહને ફાંસીની સજા સંભળાવી હતી. છેલ્લી ઘડીએ સર્વોચ્ચ કોર્ટે દયાની અરજી ફગાવી દીધી. તે પછી ૩૧ વર્ષના કલવંત સિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતીય મૂળના કલવંત સિંહની ૨૦૧૩માં ૨૦૦ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ થઈ હતી. ૨૦૧૬માં કોર્ટે ૩૧ વર્ષના કલવંત સિંહને ફાંસીની સજા સંભળાવી હતી. ગત ૩૦મી જૂને કલવંત સિંહને સિંગાપોરની સરકારે ફાંસીની સજા અમલ કરવાની નોટિસ આપી હતી અને ૭મી તારીખે ફાંસીના અમલની જાણકારી આપી હતી.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

BROKERAGE

- ☞ Free Staging
- ☞ Free Professional Photography & virtual tour
- ☞ Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- ☞ Free Comparative Market Analysis
- ☞ Team of Professional for same price as hiring a single realtor
- ☞ Over 15 years of combined experience



3+1 Bedrooms, 4 bathrooms
Welcome To 23 Ventris Dr. Beautiful Home In A Desirable Central West Community. Freshly Painted, Newer Kitchen With Quartz Countertop, Island With Breakfast Bar.W/O To Fully Fenced-In Oasis Backyard With 2 Tiered Deck & Beautiful Garden, Perfect To Entertain Guests,. Hardwood Flooring, Potlights(Inside And Outside Of The Home), New Kitchen In The Bsmt, Spacious Bedrooms. Sep.Ent To The Bsmt Thru The Garage To A 1 Bedroom In-Law Suite. Close To Hwy401, Plaza, Walking Distance To P.School.



Location!! Location!! Location!! Freshly Painted, 4 Bed Room House With 2 Bed Room Finished Basement W/ Separate Entrance. Big Corner Lot, Grand Double-Door Entry Into 2-Storey Foyer. Spacious & Bright Principal Rooms. 3-Season Sunroom W/O From Family Room & Kitchen To Awesome 2-Tiered Deck & Fenced Backyard. New Garage Doors, Close To Schools, Places Of Worship, Public Transit & All Other Amenities.



Have a happy and blessed Eid!

- ◆ No Pressure
- ◆ No Obligation
- ◆ Just Answers to Your Questions... Its that Simple!

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



ARSHA VIDYA

PRESENTS TWO HALF DAY RETREATS BY

SWAMINI PARAPRAJNANANDA SARASWATI

Retreat-1

(Topic: The Six-Fold Samadhi)

When: Saturday, 23 JULY 2022

Time: 8:30 AM to 12:30 PM

Venue: Anand Bhavan Seniors Home, Vishnu Mandir, 8642 Yonge Street, Richmond Hill, L4C 6Z4

Retreat-2

(Topic: Success Through Karma Yoga)

When: Sunday, 24 JULY 2022

Time: 8:30 AM to 12:30 PM

Venue: Room# 4, Loafers Lake Recreation Centre, 30 Loafers Lake Ln, Brampton L6Z 1X9



Swamini Paraprajnanandaji
Tattvatirtha, Ahmedabad

Swamini Paraprajnananda Saraswati is an erudite Sanyasini well versed with the knowledge of the Scriptures-Upanishads, Bhagavad Gita, Brahmasutra and other Vedantic texts. She is a senior disciple of Swami Veditatmananda Saraswatiji, Adhyatma Vidya Mandir, Ahmedabad.

Swamini Paraprajnananda Saraswati has been teaching Vedanta for the past 20 years in India. She has also conducted series of talks on Vedanta in different cities of USA and Canada since 2016. Swaminiji abides in the knowledge of the self and is also expert in imparting this knowledge to others. The depth of Swaminiji's wisdom and her art of teaching which is at once profound and lucid make her an expert teacher from whom learning is a joy.

Swamini Paraprajnananda Saraswati's experience as a professor of English in the past facilitates her to adeptly handle the subject at hand and communicate it to the audience. Besides being a gifted teacher, Swaminiji is also very simple, loving and compassionate as a person.

Registration fee for each retreat is \$20.00 (\$40 for both)

A light breakfast will be served.

Please register ONLINE at: WWW.ARSHAVIDYA.CA

(Limited sitting for both Retreats)

You may contact for details: Rajesh Patel (416) 846-5282, Mahendra Shah (905) 773-2689



CORDIALLY INVITES



Founder & Inspired By
His Divine Holiness Vaishnacharya Pujya Goswami 108
SHRI VRAJRAJKUMARJI MAHODAYSHRI



VYO SHRI KRUSHNA DHAM SANKUL
VRAJBHOOMI CALEDON
TORONTO (CANADA)



ORGANIZING A FUND RAISING
EVENING EVENT OF

BHAKTI SANGEET

SANDHYA

By

PRAMESH NANDI



TICKETS
\$50
PER PERSON
WITH DINNER

16th Saturday
July, 2022

6 pm - 10 pm
(Dinner - 6 pm to 7 pm)

Venue:

Shri Krushnadhama Sankul-Vrajbhumi
18111 Hwy 50, Caledon, Ontario, Canada



Master of Ceremony
SANJAY SHAH

Event Leader: **Rajesh Shah 647-269-5959**

Chairman Kirit Shah (Ottawa) 613-725-4320	President P.K.Shah 416-918-5054	Pujya Shri's Chief Secretary, Canada Sandip Marfatia 416-722-7140	Vice-President Subhash Shah 416-707-7098	Secretary Nimesh Shah 647-784-4743	Treasurer Avni Marfatia 416-471-7140	Fund Raising PR Nikunj Shastri 647-802-5227
---	---------------------------------------	---	--	--	--	---

18111 Highway 50, Caledon, ON L7E 3J9 (416) 421-7373 canadavyo@gmail.com

Sponsors

<p>Unique Consulting Group Canadian Immigration Services www.uniquecg.com</p> <p>Sandip Marfatia (MCC) Avni Marfatia (MCC)</p> <p>1-888-288-4888 / 416-292-7340 416-292-4888 / 416-471-3740</p> <p>55 Dufferin Ave., Suite 203, Toronto, ON M1S 1L1, Canada</p>	<p>KRISHNA SHAH, P. Eng Phone : 647-270-5556 kshah@exceleng.ca www.exceleng.ca</p> <p>EXCEL ENGINEERING</p> <p>DESIGN BUILD - Residential & Commercial Projects</p>	<p>PEGASUS MORTGAGE LENDING CENTER INC. MORTGAGE BROKER</p> <p>Neerav SB Mortgage Agent</p> <p>1627 Finchway Rd., Suite 202 Toronto, ON M1S 1C4 Office: (416) 291-8628 / Fax: (416) 943-0463 1-800-402-8777 neeravsb@pegasus.com / neeravsb@realty.com</p>	<p>SAAB SAHOTA KING REALTY BROKERAGE</p> <p>Owner and Broker of Record THINK BIG JOIN KING</p> <p>905.793.KING (5464) saab@kingrealtybrokerage.ca</p> <p>www.kingrealtybrokerage.ca 18 First St. E. Ste. 1, Brampton, ON, L6Y 4R1</p>	<p>PHARMASAVE</p> <p>MIT SHAH Pharmacy Manager/Owner</p> <p>PRANAY PARIKH Pharmacist/Owner</p> <p>PARR PHARMACY 112 Parr Blvd #3, Bolton, ON, L7E 4H1 Phone: 905-533-5099 Fax: 905-533-5799 Email: parrpharmacy@gmail.com YOUR COMMUNITY PHARMACY</p>	<p>FINANCIAL HORIZONS GROUP Professional Services</p> <p>PRAVIN (P.K.) SHAH Insurance & Financial Services Director</p> <p>405 Dufferin Drive, Suite 800, Markham, Ontario L3R 9W6 Tel: 905-212-8339 • Fax: 905-212-8564 Tel: 416-286-8550 Fax: 905-513-8882 Email: pravinsg@gmail.com Serving in the Insurance Industry from over 22 years in Canada</p> <p>Engage Life Manulife Sun Life Financial</p>
<p>Mina Patel Law Professional Corporation</p> <p>Mina Patel Barrister, Solicitor & Notary Public Family Mediator</p> <p>647-814-3172 416-945-1709 minapatel.law@gmail.com www.minapatel.law.com</p> <p>37 Spring Town Road Vaughan, L4L 8G2 Canada</p>	<p>HOMELIFE HomeLife/Miracle Realty Ltd., Brokerage</p> <p>JIGNESH PATEL REAL ESTATE BROKER</p> <p>647-381-1492 realtor@jignesh.ca</p> <p>5912 Steeles Ave. W., Suite 114 Toronto, ON M9V 3C4 Office: 416-747-8777 Fax: 416-747-7135</p>	<p>HOMELIFE HomeLife/Miracle Realty Ltd., Brokerage</p> <p>Dhaval Shah Sales Representative</p> <p>Call: 647-991-2906 Office: 905-455-5100 Fax: 905-455-5110 dshah@realty.com</p>	<p>KING REALTY BROKERAGE</p> <p>THINK BIG JOIN KING</p>	<p>NEKUNJ SRASHTRI 647-882-5227</p> <p>CAPITAX FINANCIAL INC.</p> <p>Financial Services</p> <p>647-789-8986 info@capitaxfinancial.com</p>	<p>SHILPESH PARIKH Insurance & Financial Services Director</p> <p>647-992-6951 shilpesh12@gmail.com www.shilpesh12.ca</p> <p>HomeLife Realty Life Insurance Financial Services Investment Wealth Management</p> <p>821 Denison St. W., Unit 51, Brampton, ON L6Y 4Y9 • Office: 905-455-3100 BUY-SELL-LEASE-RENT</p>
<p>HOMELIFE/Miracle Realty Ltd. Brokerage</p> <p>ASHWIN RANINGA Sales Representative</p> <p>Call: 647-296-3690 Office: 416-747-9777 Fax: 416-747-7135 ashwinraninga@gmail.com</p>	<p>SHRIJI DINE-IN, TAKE-OUT, & CATERING (PURE VEGETARIAN)</p> <p>RAMABEN PATEL</p> <p>905-451-4050 647-204-8969</p> <p>71 West Drive, Unit 3A, Brampton, ON L6T 2E2</p>	<p>Keyur Shah Professional Corporation</p> <p>Keyur Shah Barrister, Solicitor & Notary</p> <p>1780 Albion Rd., Unit # 5, Toronto ON M9V 1C1 Phone: 416.745.6100 Email: info@shahlaw.ca www.shahlaw.ca</p>	<p>RTI Radiant Technologies Inc. Electronic Contract Manufacturing Services</p> <p>Subhash Shah President</p> <p>7755 Warden Avenue, Unit #6 Markham, Ontario, Canada L3R 0N3 Tel: (905) 940-8555 Fax: (905) 940-4144 subhash@radianttechnologies.ca www.radianttechnologies.ca</p>	<p>ROSEWOOD Cabinets & Kitchen Inc.</p> <p>Office: 416-744-9030 Fax: 416-850-1810</p> <p>23 Westmore Dr. Unit#8, Rexdale, ON M9V 3Y7</p>	<p>Shivam Financial Services Inc. QAFP</p> <p>Manish Desai Member of Canadian Association of Insurance & Financial Advisors</p> <p>Office: (905) 913-6660 Mobile: (416) 731-1666 Email: manishd@shivamfinancial.com www.shivamfinancial.com</p>
<p>NATIONAL BANK</p> <p>Sachin Patel Mortgage Development Manager</p> <p>National Bank of Canada 50020 Lakeshore Rd, Brampton, ON L6L 3P6</p> <p>Call: 647-772-9082 sachin.patel@nbcc.ca</p>	<p>HOMELIFE HomeLife/Miracle Realty Ltd., Brokerage</p> <p>NEEL SONI</p> <p>Direct: 416-835-0883 Email: neelsoni@realty.com</p> <p>610-451-4000 / 905-463-0812 610-451-4000 / 905-463-0812</p>	<p>EYECONE OPTICAL</p> <p>SAMIR PATEL, JAYMINI PATEL</p> <p>416-299-1533 416-299-1472</p> <p>6055 Steeles Avenue East, Suite C-101 (Yellow Building), Toronto ON M1X 0A7</p> <p>5637 Finch Ave. (East), Unit #4, Scarborough, ON M1B 2T9</p>	<p>Prism Homes</p> <p>416-294-8119 prismhomes.gt@gmail.com</p> <p>25 Tamarisk Dr. Etobicoke, ON M9V 1S2</p>	<p>Joshi Law Office Barrister, Solicitor & Notary Public</p> <p>Rakesh Joshi B.A., LL.B.</p> <p>6921 Steeles Avenue W, Unit 11, Etobicoke ON M9W 6T5 416-213-8600 www.joshilawoffice.com</p>	<p>VYO CANADA APPRECIATE AND THANK ALL SPONSORS FOR THEIR GENEROUS DONATION & SUPPORT</p>

For Tickets Please Contact :
Rajesh Shah (Event Leader) 647-269-5959 P.K. Shah (President) 416-918-5054 Nimesh Shah (Secretary) 647-784-4743 Chetna Shah 647-390-5969
OR Other Board Officers
(Please Strictly Follow Covid-19 Government Guidelines)